

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૨૫ ઓક્ટોબર ૨૦૨૪, શુક્રવાર
વિક્રમ સંવત ૨૦૮૦, આસો વદ ૯

વર્ષ : ૧૬
અંક : ૧૧૬

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

ફિલિપાઈન્સમાં ટ્રામી વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી સર્જાયું

અસરગ્રસ્તો સુધી ભોજન-પાણી પહોંચાડવું પણ મુશ્કેલ બન્યું : પુરના કારણે રસ્તાઓ પર કારો વહી છે, તમામ શાળાઓ-કોલેજો બંધ કરવાની જાહેરાત



। (એજન્સી) ફિલિપાઈન્સ, તા.૨૪ ।
ફિલિપાઈન્સમાં ટ્રામી વાવાઝોડું ત્રાટકતા ભારે વિનાશ થયો છે. તોફાનના કારણે ઓછામાં ઓછા ૨૬ લોકોના મોત અને દોઢ લાખ લોકોએ પોતાનું

ઘર છોડવાની નોબત આવી છે. વાવાઝોડાના કારણે મૂશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે. પુરના કારણે રસ્તાઓ પર કારો વહી છે, તો બીજાતરફ સરકારે તમામ શાળાઓ અને કોલેજો બંધ કરવાની જાહેરાત કરી છે. પૂર્વોત્તર પ્રાંતમાં વાવાઝોડું ટ્રામી લેન્ડફોલ થયા બાદ ફિલિપાઈન્સમાં ભારે જાનહાની સર્જાઈ છે. લાખો લોકોને બચાવવા માટે આજે બીજા દિવસે પણ પુરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે. ઘરની છત પર ભસાયેલા અનેક લોકોને બચાવવા માટે બોટોનો સહારો લેવામાં આવ્યો છે. પૂર અને ભૂસ્ખલનની સૌથી વધુ અસર બિકોલ વિસ્તારમાં થઈ છે. અહીં અનેક સ્થળો જળમગ્ન થયા છે. મળતા અહેવાલો મુજબ અનેક સ્થળે પાણી ભરાવથી અને તેમાં ડૂબી જવાના કારણે મોટાભાગના લોકોના મોત નિપજ્યા છે. જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા છે, ત્યાં ૧૫૦૦ પોલીસ કર્મચારીઓ

પુરજોશમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. પ્રાદેશિક પોલીસ વડા બ્રિગેડિયર આન્ડ્રે ડિઝોને કહ્યું કે, 'ફસાયેલા લોકોની સંખ્યા વધુ છે, તેથી એક વખતમાં તમામને બચાવી લેવા અસંભવ છે. અમને વધારાની બોટની જરૂર છે. પ્રભાવિત લોકોને તાત્કાલીક બહાર કાઢવા મુશ્કેલ છે. અમે અસરગ્રસ્ત લોકો સુધી ભોજન અને પાણી કેવી રીતે પહોંચાડવું, તે અંગે અમે વિચાર કરી રહ્યા છીએ.'

અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ હવામાનની સ્થિતિ અત્યંત ખરાબ છે અને તેના કારણે રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બરમાં યાગી વાવાઝોડાએ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી હતી. ફિલિપાઈન્સમાં દર ઉનાળામાં લગભગ ૨૦ વાવાઝોડા આવે છે. ૨૦૧૩માં હયાન વાવાઝોડાના કારણે ૭૩૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક ગામો નષ્ટ થઈ ગયા હતા.



વોશિંગટન સુંદરે તેના પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. તેના કારણે જ ન્યૂઝીલેન્ડ પહેલી ઈનિંગમાં ૨૫૯ રન પર ઓલઆઉટ થઈ હતી.

વોશિંગટન સુંદરે વાપસી કરતાં જ તોફાની પ્રદર્શન કર્યું ૧૩૨૯ દિવસ પછી વોશિંગટન સુંદરની ટીમ ઈન્ડિયામાં વાપસી ભારતીય ટીમમાં આવતાવેંત જ ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ખેરવી રોહિત અને ગંભીરના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો

। (એજન્સી) વુડે, તા.૨૪ ।
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે (૨૪ ઓક્ટોબર) ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીરે મોટો દાવ લગાવી ૧૩૨૯ દિવસ બાદ સુંદરને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. રોહિત અને ગંભીરના આ નિર્ણયની અનેક ક્રિકેટ ટિપ્પણીઓએ ટીકા કરી હતી. જો કે, વોશિંગટન સુંદરે વાપસી કરતાં જ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે ભારતીય ટીમમાં આવતાવેંત જ ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ખેરવી રોહિત અને ગંભીરના નિર્ણયને યોગ્ય સાબિત કર્યું છે. વોશિંગટન સુંદરે રોહિત અને ગંભીરની અપેક્ષાઓ પર ખરો ઉત્તરી પોતાની કમબેક મેચમાં તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડના બેટિંગ ફોર્મેટની કમર ભાંગી નાખી છે. પહેલી ઈનિંગમાં

ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ઝડપી સુંદર ભારતના સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે તેણે તેના કારિયરનું અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. નોંધનીય છે કે, આ પહેલી વખત છે જ્યારે સુંદરે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં પાંચથી વધુ વિકેટ ઝડપી હોય.

વોશિંગટન સુંદરે આ મુકાબલામાં સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના સ્ટાર યુવા ખેલાડી રચિન રવિન્દ્રની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેણે ટોમ બ્લંડલ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એઝાઝ પટેલ અને મિચેલ સ્ટેન્ટનર જેવા સ્ટાર ખેલાડીઓનો શિકાર કર્યો હતો. ખાસ વાત એ છે કે સુંદરે તેની સાત વિકેટમાંથી પાંચ ક્લિન બોલ કરીને ઝડપી હતી. આ મેચની શરૂઆત પહેલા વોશિંગટન સુંદરને પ્લેઈંગ ૧૧માં સ્થાન આપવા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. હકિકતમાં, વોશિંગટન સુંદરે આ મેચમાં કુલદીપ યાદવની જગ્યા લીધી હતી.

ચક્રવાતી તોફાન દાનાને લઈને ૨ રાજ્યોમાં રેડ એલર્ટ, ૬ રાજ્યોમાં અસર

। નવી દિલ્હી, તા.૨૪ ।
દેશના ૨ રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી ૨૪ કલાક ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર બનેલું ચક્રવાતી તોફાન દાના તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે ૨૪ ઓક્ટોબરના રોજ સાંજથી કાલ રાત્રી ૨૫ ઓક્ટોબર સવાર સુધી આ સમુદ્રી તોફાન ઓડિશાના પુરીમાં દરિયા કાંઠે ત્રાટકી શકે છે. તેના પ્રભાવનું અનુમાન જાતા હવામાન વિભાગે (IMD) ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. ચક્રવાતી તોફાન દાના પૂર્વ મધ્ય અને તેની નજીક પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મંડરાઈ રહ્યું છે. ગઈ કાલે તોફાન એ જ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. હાલ તોફાન પારાદીપ (ઓડિશા)થી લગભગ ૪૨૦ કિમી દક્ષિણ પૂર્વ, ધમારા (ઓડિશા)થી ૪૫૦ કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને સાગર દીપ(પશ્ચિમ બંગાળ)થી ૫૦૦ કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં છે. તેના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને આજે ૨૪ ઓક્ટોબરના રોજ સવાર સુધીમાં મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ભીષણ ચક્રવાતી તોફાનના ફેરવાઈ જવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો રાજ્યનો દરજ્જો મળશે : અમિત શાહ

દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાય

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૪ ।
જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો રાજ્યનો દરજ્જો મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કામગીરી શરૂ થઈ શકે છે. જો કે, સત્તાવાર જાહેરાત થઈ નથી. બુધવારે સાંજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મોટી બેઠક યોજાઈ હતી. સરકાર જમ્મુ બનાવ્યા બાદની પ્રથમ બેઠકમાં જ



એનસી સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અડધો કલાક સુધી ચાલનારી આ બેઠક સકારાત્મક રહી હતી. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યનો દરજ્જો આપવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. જેનો સંકેત ઓમર અબ્દુલ્લાહે પણ આપ્યો છે. ઓમર અબ્દુલ્લાહે આ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે, આ એક શિષ્ટાચારની ભેટ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મુદ્દે ચર્ચા કરી. જમ્મુ-કાશ્મીરને ૨૦૧૯માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું.

આપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અડધો કલાક સુધી ચાલનારી આ બેઠક સકારાત્મક રહી હતી. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યનો દરજ્જો આપવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. જેનો સંકેત ઓમર અબ્દુલ્લાહે પણ આપ્યો છે. ઓમર અબ્દુલ્લાહે આ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે, આ એક શિષ્ટાચારની ભેટ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મુદ્દે ચર્ચા કરી. જમ્મુ-કાશ્મીરને ૨૦૧૯માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું.

૨૮ ઓક્ટોબર ડેડલાઈન આપી કેનેડાના ટૂંકો ફરી મુશ્કેલીમાં, સાંસદોની રાજીનામાની માગ

। (એજન્સી) ઓટાવા, તા.૨૪ ।
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પોતાના જ દેશમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના જ પક્ષના ૨૦ સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. એટલું જ નહીં લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રૂડોને આ અંગે નિર્ણય લેવા માટે ૨૮ ઓક્ટોબરની ડેડલાઈન



આપી છે. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું છે કે જો ટ્રૂડો આ ડેડલાઈન સુધીમાં રાજીનામું નહીં આપે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. કેનેડામાં જસ્ટિન ટ્રૂડો અને તેમની લિબરલ પાર્ટીની જોકપ્રિયતામાં

ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમના પર વડા પ્રધાન પદ છોડવાનું દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં ટ્રૂડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે. પરંતુ પાર્ટીના ૨૦ સાંસદોએ વિપરીત નિવેદનો આપ્યા હતા. આ સાંસદોએ એક પત્ર દ્વારા ટ્રૂડોને ચૂંટણી પહેલા રાજીનામું આપવાની માંગ કરી છે. આ પત્ર લિબરલ પાર્ટીની બેઠકમાં વાંચવામાં આવ્યો હતો.

યુનાઈટેડ કિંગડમથી એક લાખ કિલો સોનું પરત લાવવામાં આવ્યું

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૪ ।
ભારત હાલમાં જ યુનાઈટેડ કિંગડમથી ૧,૦૦૦ ટન એટલે કે એક લાખ કિલો સોનું લાવ્યું છે. આ સોનું ભારતનું હતું, પરંતુ તેને યુ.કે.માં સ્ટોર કરાયું હતું. આ સોનાને ભારત લાવવું એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ભારતની આર્થિક સ્થિતિને ભૂસ્ત કરવા માટે યુકેથી સોનું પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોનું વર્ષોથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. કોર-સીમાં વધ-ઘટ અને કુંગાવા સામે સોનું જ સૌથી સુરક્ષિત છે. સોનામાં વધુ રોકાણ કરીને ભારત તેની

આર્થિક મજબૂતીમાં વધારો કરવા માંગે છે. વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ, ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ૧૯૯૦ના દાયકામાં ભારતનું અર્થતંત્ર નબળું હતું અને તે સમયગાળામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોનું ગિરવે મૂકવું પડ્યું હતું. વર્ષ ૨૦૨૪માં આ સોનાને પરત લાવી શકાયું, તે ભારતમાં પરિવર્તનનો સંકેત છે. એટલું જ નહીં, તે દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતાની પણ નિશાની છે. એક લાખ કિલો સોનું યુનાઈટેડ કિંગડમથી લાવવું કોઈ સહેલું કામ ન હતું.

રાજસ્થાનમાં કારનું ટાયર ફાટતા ગોઝારો અકસ્માત અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા

। (એજન્સી) જયપુર, તા.૨૪ ।
રાજસ્થાનમાં બ્યાવર-પિંડવાડા હાઈવે પર ગુરુવારે સવારે લગભગ ૭:૧૫ વાગે ટાયર ફાટવાના કારણે ગોઝારો અકસ્માત સર્જાયો. કાર નાળામાં પડી ગઈ અને એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા. કારમાં સવાર લોકો પિંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યા હતા. પીડિત પરિવાર ગુજરાતના દાહોદનો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર થઈ શકી નથી. આ દુર્ઘટના અંગે એસપીએ જણાવ્યું કે 'કારનું સંતુલન ખોરવાતા અકસ્માત થયો છે. પાંચ લોકોના મોત નીપ

જ્યા છે જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિરોહીમાં સારનેશ્વર બ્રિજ નજીક આ દુર્ઘટના ઘટી છે. કારનું ટાયર ફાટવાથી કાર બેકાબૂ થઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી.' બીજી તરફ સિરોહી પોલીસે જણાવ્યું કે 'કારમાં સવાર એક પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે સારનેશ્વર બ્રિજ નજીક કારની આગળનું ટાયર ફાટી ગયું, જેનાથી કાર બેકાબૂ થઈને ડિવાઈડરને પાર કરતાં નાળામાં પડી ગઈ.' દુર્ઘટના અંતેલી દર્દનાક હતી કે ફલોદીના ખારા ગામના રહેવાસી બે મહિલા, બે પુરુષ અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

ભારતના છોકરાએ Googleમાં ૨ કરોડના પેકેજ સાથે મેળવી નોકરી

। (એજન્સી) જમ્મુ, તા.૨૪ ।
બિહારના જમ્મુ જિલ્લાના નાના શહેર ઝાઝાના અભિષેક કુમારે સંપૂર્ણ નિશ્ચય અને સમર્પણ દ્વારા અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પ્રતિભાશાળી યુવા સોફ્ટવેર એન્જિનિયરે આ પ્રતિભાશાળી યુવા સોફ્ટવેર એન્જિનિયરે રૂ. ૨.૦૭ કરોડના વાર્ષિક પેકેજ સાથે ગૂગલમાં નોકરી મેળવી છે. હવે તે ગૂગલની લંડન ઓફિસમાં સેવા આપશે. અભિષેક કુમાર જમ્મુ જિલ્લાના ઝાઝા બ્લોક વિસ્તારના જમ્મુપરિયાનો રહેવાસી છે. હાલમાં અભિષેક શરૂ કર્યું અને ત્યાં તેની તૈયારી તેના સમગ્ર પરિવાર સાથે ઝાઝામાં

રહે છે. અભિષેકના પિતા ઈન્દ્રદેવ યાદવ જમ્મુ સિવિલ કોર્ટમાં વકીલ છે, જ્યારે તેની માતા મંજુ દેવી ગૃહિણી છે. ગુગલમાં અભિષેકની પસંદગી થાય તે પહેલા જ વર્ષ ૨૦૨૨માં અભિષેકને એમેઝોન તરફથી સારું પેકેજ મળ્યું હતું. અભિષેકને એમેઝોન દ્વારા ૧ કરોડ ૮ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર નોકરી આપવામાં આવી હતી, જ્યાં તેણે માર્ચ ૨૦૨૩ સુધી કામ કર્યું હતું. આ પછી તેણે નોકરી છોડી દીધી. પછી તેણે મેક્સિકન કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં તેની તૈયારી તેના સમગ્ર પરિવાર સાથે ઝાઝામાં

શહેરમાં રખડતાં ટોર-ફૂતરાને ચીપ અને ટેગ લગાવવા માટે ૧.૮૦ કરોડનો ખર્ચ કરાશે

૧ (એજન્સી) અમદાવાદ, તા.૨૪ | અમદાવાદ શહેરને ૨૦૩૦ સુધીમાં રેબિસ(હડકવામુક્ત) ફી સિટી બનાવવા માટે રખડતાં ફૂતરાનાં પસીકરણ અને રસીકરણની સાથે સાથે કમ્યુટરાર્થ ડેટા એક્ટ્ર કરવા માટે આરએફઆઈડી માર્ફકોચીપ તથા વિજ્યુઅલ ઈયર ટેગ લગાવવામાં આવશે, જેની પાછળ ૧.૮૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિ. સીએનસીડી ખાતાનાં સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારનાં રેબિસ ફી સિટી પ્લાનને અમદાવાદ મ્યુનિ.એ સ્વીકાર્યો છે અને ૨૦૩૦ સુધીમાં શહેરમાં રખડતાં ફૂતરાને પસીકરણ, રસીકરણની સાથે ચીપ અને ટેગ લગાવવામાં મહત્વની



કામગીરી કરવામાં આવનાર છે. સૂત્રોએ કહ્યું કે, રખડતાં ફૂતરાને હાલમાં પકડીને પસીકરણ તથા રસીકરણ કરી પાછું મૂળ જગ્યાએ છોડવામાં આવે છે. આ કામગીરીમાં ફૂતરાનાં કાનનો એક હિસ્સો કાપવામાં આવે છે, જેથી ખબર પડે કે આ ફૂતરાનું પસીકરણ અને રસીકરણ થયેલું છે. પરંતુ આગામી

સમયમાં આવા ફૂતરાને ફરી રસી આપવાની થાય ત્યારે તેને અગાઉ કર્યારે રસી અપાઈ તેની માહિતી હોતી નથી અને તેવો કોઈ ડેટા એક્ટ્ર કરવામાં આવેલો નથી. આથી કેન્દ્ર સરકારનાં પ્લાન અંતર્ગત રખડતાં ટોરની સાથે સાથે હવે રખડતાં ફૂતરા પ કડાશે તો તેને પસીકરણ અને રસીકરણ કર્યા બાદ કાન કાપવાને બદલે મોટા ઢોરની જેમ વિજ્યુઅલ ઈયર ટેગ લગાવવામાં આવશે તેમજ ઈન્જેક્ટીબલ એલ્બીકેટરની મદદથી આરએફઆઈડી ચીપ લગાવવામાં આવશે. આ કામગીરીથી ફાયદો એવો થશે કે, રખડતાં ફૂતરાની ફરિયાદ આવે ત્યારે પ કડવા જનારી ટીમ પણ સાધનસામગ્રી સાથે જશે અને સ્થળ ઉપર ફૂતરા પકડીને તેનાં ચીપ-ટેગની

તપાસ કરી જાણી શકશે કે આ ફૂતરાને ક્યારે પ કડીને પસીકરણ તથા રસીકરણ કરાયું છે. જો ફૂતરા પકડનારી ટીમ પાસે સાધન નહિ હોય તો ફૂતરા પ કડીને જ્યાં લાવવામાં આવશે ત્યાં આ પ્રકારનું ચેકિંગ કરી શકાશે. એકંદરે રખડતાં ફૂતરાને સમયાંતરે રસીકરણનું ઈલેક્ટ્રોનિક કેલેન્ડર અને ડેટા તૈયાર કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવશે, જેની અસર આગામી વર્ષોમાં ટેબાઈ આવશે. સૂત્રોએ કહ્યું કે, સીએનસીડી ખાતા પાસે હાલમાં ૧૨૦૦ નંગ ચીપ અને ટેગનો જથ્થો છે, તેની સામે નવા વિસ્તારોમાંથી પકડાતાં રખડતાં ઢોર અને ફૂતરાને ચીપ-ટેગ લગાવવા માટે બીજો વધારે જથ્થો મંગાવવા માટે ૧.૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ન્યૂઝ ફિક્સ

પાટણના વેપારીને રેશનકાર્ડ માટેની એલેક્ટ્રોનિક ડાઉનલોડ કરવી ભારે પડી

૧ (એજન્સી) પાટણ, તા.૨૪ | પાટણના વેપારીએ રેશનકાર્ડ અપડેટ કરવા માટે એલેક્ટ્રોનિક ડાઉનલોડ કરી હતી પરંતુ ગડિયાઓએ વેપારીના મોબાઈલને હેક કરી બે ખાતામાંથી ૨.૪૬ લાખનું સાયબર ફોડ કરી ગયા હતા. આ મામલે તેઓએ ગાંધીનગર સાયબર સેલમાં જાણ કરતાં તેઓએ પાટણ જિલ્લા પોલીસ સાયબર કાર્ડમ પોલીસને આ ફરિયાદ મોકલતાં તેમણે બનાવની તપાસ કરીને સાયબર ફોડનો ભોગ બનેલા પરિવારને જાણ કરી આ મામલે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલાએ ફરિયાદ નોંધાવી છે. પાટણના નવાગંજમાં એચ.પી. ટ્રેડર્સ નામની પેટ્રોલ વેપારી પ્રકાશકુમાર રતિલાલ ઠક્કર (રહે. રાજવંશી બંગ્લોજ, મીરા દરવાજા, પાટણ) એ પાટણ બી-વી.લીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના મહેસાણા અર્બન બેંકના ખાતામાં રૂ. ૨,૯૮,૦૦૦ પડેલા હતા.

છત્રાલમાં દવાની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું, રૂ. ૩ લાખ ચોરી ગયા

૧ (એજન્સી) ગાંધીનગર, તા.૨૪ | શિયાળાનો આરંભ થતાની સાથે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત તાલુકા મથકોમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ એક પછી એક ઘરફોડ સહિતની ચોરીના બનાવોને અંજામ આપી રહી છે. તેના કારણે સામાન્ય પરિવારોમાં ચોરીનો ભય વ્યાપી ગયો છે. કલોલ તાલુકાના છત્રાલમાં આવેલા મેડિકલ દુકાનનું શટર તુટવાના બનાવે વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો છે. આ અંગે અમિતકુમાર જગદીશભાઈ પટેલ (કલોલ)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ છત્રાલના રાધે શ્યામ શોપિંગ સેન્ટર ખાતે ઉમિયા મેડિકલ સ્ટોર ચલાવે છે. ગઈ કાલે દુકાન ખોલી દિવસે ધંધો કરીને રાત્રે તાળુ મારી ઘરે ગયા હતાં. બીજા દિવસે દુકાનનો કર્મચારી દુકાને આવ્યો ત્યારે શટર તુટેલું જોવા મળતા દુકાન માલિકને ફોન કર્યો હતો. વાત જાણી અમિતકુમાર દોડી આવ્યા હતાં અને દુકાનમાં તપાસ કરતા રાતના સમયે દુકાન બંધ કરતા સમયે ડ્રોવરમાં ૩ લાખ રૂપિયા રોકડા મુક્યા હતા તે ચોરાઈ ગયાનું જણાયું હતું. તસ્કરો આગળનું લોક મોવી સ્ટોર્સમાં ઘુસ્યા હતા અને અંદરના ભાગે રહેલી સ્વાઈચડરવાળી બારીનો કાચ તોડી કેશ ડ્રોવર ખોલી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

દિલ્હી પ્રથમ ક્રમાંક ઉપર અમદાવાદ દેશનું સાતમા નંબરનું વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું

દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઈટ ચાલે છે ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઈટ મુખ્યમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો છે

૧ (એજન્સી) અમદાવાદ, તા.૨૪ | અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઈટ ચાલે છે. દર ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઈટ મુખ્યમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ૨૭૦ જેટલી ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. વર્ષ ૨૦૨૪ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ૬૦ લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. જેમાંથી ૫૦ લાખ મુસાફરોએ ઘરેલુ મુસાફરી કરી છે જ્યારે ૧૦ લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે. જેમાં દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ છે. દિલ્હી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જ્યાં દર ૧.૫ મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થાય છે. અહીં દરરોજ ૧૧૦૦ થી વધુ ફ્લાઈટ્સ ચાલે છે અને મુંબઈ એરપોર્ટ બીજા સ્થાને છે, ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા છે. તે પછી ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ એટલે

કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાતમા નંબરે આવે છે. જ્યાં આ વર્ષના છેલ્લા મહિનામાં દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થઈ છે. વર્ષ ૨૦૨૪માં અમદાવાદ એરપોર્ટ પરથી એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ૪૮૦૦૦થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે. એટલે કે ગયા વર્ષના ૪૮૦૦૦થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ૨૭૦ જેટલી ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૨૦ થી ૨૩૦ ફ્લાઈટ્સ સંચાલન કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એરપોર્ટ છે. જેના કારણે અનેક નવી કનેક્ટિવિટી પણ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે કારણ કે મુસાફરોને સીધી

કનેક્ટિવિટી પણ મળે છે. અમદાવાદ એરપોર્ટ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ૬૦ લાખથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જેમાંથી ૫૦ લાખ મુસાફરોએ ઘરેલુ અને ૧૦ લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે. ગયા વર્ષની સરખામણીમાં સ્થાનિક કનેક્ટિવિટી અને મુસાફરોની સંખ્યામાં ૬ ટકા જ્યારે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી અને મુસાફરોની સંખ્યામાં ૧૫ ટકાનો વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડતી ફ્લાઈટ્સ માટે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સૌથી લોકપ્રિય સ્થળો છે. જ્યારે દુબઈ, અબુ ધાબી અને કુવૈતથી સૌથી વધુ મુસાફરો આવતા અને પ્રસ્થાન કરતા આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ટોચના સ્થળો તરીકે ઉભરી આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી દર વર્ષે ફ્લાઈટ ઓપરેશન્સ અને કનેક્ટિવિટી વધી રહી છે, તેથી વર્ષ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે અમદાવાદથી મુસાફરોને ડાયરેક્ટ કનેક્ટિવિટી આપવા માટે નવા ડિસ્ટિનેશન શરૂ કર્યા છે.

ગુજરાત અને હૈદરાબાદના આરોપીઓ સામે કાર્યવાહી અમેરિકન વિઝાના નામે રૂ. ૪૧.૭૫ લાખની છેતરપિંડી

૧ (એજન્સી) અમદાવાદ, તા.૨૪ | અમેરિકન વિઝા અપાવવાના નામે અમદાવાદના વેપારી અને અન્ય પાંચ-છ લોકો પાસેથી રૂ. ૪૧.૭૫ લાખની છેતરપિંડી નો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે ગુજરાત CIDએ વિઝા કન્સલ્ટન્ટ અને તેના હૈદરાબાદ સ્થિત કઝીન વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આ છેતરપિંડી ગયા વર્ષે માર્ચથી શરૂ થઈ હતી અને એક વર્ષ સુધી ચાલુ રહી હતી. તેની ફરિયાદ ૭ ઓક્ટોબરે દાખલ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, ગુજરાત CID એ અમદાવાદના વેપારી સાવન પટેલ અને અન્ય પાંચ-છ લોકો સામે કુલ રૂ. ૪૧.૭૫ લાખની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. વિઝા કન્સલ્ટન્ટ ચિતન મિશન અને

તેના હૈદરાબાદ સ્થિત પિતરાઈ ભાઈ સાગર મિશન પર આ છેતરપિંડીનો આરોપ છે. બંનેએ અમેરિકન વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે સાવન પટેલ માર્ચ ૨૦૨૩માં એક મિત્ર મારફતે ચિતન મિશનને મળ્યો હતો. ચિતન બાપુનગર વિસ્તારમાં કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન ચલાવતો હતો. પોતાને વિઝા કન્સલ્ટન્ટ ગણાવતા, તેણે પટેલને ૪ લાખ રૂપિયામાં બે બાળકો માટે વિઝા એપોઈન્ટમેન્ટ અપાવવાની ખાતરી આપી. ચિતને દાવો કર્યો હતો કે તેનો પિતરાઈ ભાઈ સાગર હૈદરાબાદમાં ઈમિગ્રેશન વિભાગમાં કામ કરે છે અને તેને યુએસ વિઝા અપાવી શકે છે.

કચ્છના માંડવીમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી એક જ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, ગ્રામજનોમાં છવાઈ શોકની લાગણી

૧ (એજન્સી) કચ્છ, તા.૨૪ | કચ્છના માંડવીમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયા હતાં, જ્યાં આકસ્મિક રીતે બંને બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે, રેતી ચોરવા આવેલાં લોકોએ ખાડો કર્યો હતો જેમાં પડી જવાથી બંને બાળકો તળાવમાંથી બહાર નીકળી શક્યાં અને તળાવમાં જ મૃત્યુ પામ્યાં. માંડવીના ન્યૂ મારવાડા વાસમાં રહેતાં બે બાળકો માંડવી-નલિયા રોડ પર ભેંસ ચરાવવા ગયા હતાં. જોકે, ત્યાં આકસ્મિક રીતે બંને

મુતક બાળકોનીસ ઓળખ ૧૨ વર્ષનો હીરજી મારવાડા અને ૧૦ વર્ષના ઓકેશ મારવાડા તરીકે થઈ ચિંતા થવા લાગી. ભેંસોને બાંધીને પ રિવાર તેમજ ગ્રામજનો બાળકોને શોધવા નીકળ્યા હતાં. ત્યારે તેમને તળાવના કિનારે બાળકોના ચંપલ અને લાકડી મળી આવી હતી. તળાવના કિનારે બાળકોના ચંપલ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક તરવેયા અને ફાયર બ્રિગેડને બોલાવી બાળકોની શોધ કરવાનું શરૂ કર્યું હતું. લાંબી શોધખોળ બાદ તળાવમાંથી બંને બાળકોની લાશ મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતાં.

મિત્રના પ્રેમ પ્રકરણમાં યુવકને મળ્યું મોત, લાકડી અને પાઈપથી માર મારી પતાવી દીધો

૧ (એજન્સી) અમરેલી, તા.૨૪ | અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ચોકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ૩૩ વર્ષીય મનુ ઉર્ફે મામયો મકવાણા નામના વ્યક્તિને પોતાના મિત્ર સાથે જવું ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. નાગ વજીર નામનો મિત્ર પોતાની પરિણીત પ્રેમિકાને મળવા જતા સમયે પોતાના જ ગામના મનુ મકવાણાને સાથે રાખતા પરિણીત પ્રેમિકાના પરિવારજનોએ બંને મિત્રો પર હુમલો કરતા હુમલામાં નિર્દોષ મનુ મકવાણાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. લાકડી અને પાઈપથી માર્યો માર ૩૩ વર્ષીય મનુ ઉર્ફે મામયો મકવાણા નામના વ્યક્તિની લાકડી તેમજ પાઈપ વડે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વિશેષ

વડાપ્રધાનના નેતૃત્વથી પ્રેરાઈ એક યુવતી કોલેજ પાસઆઉટ થઈ સીધી બની ગામની સરપંચ

૧ દર્શન ત્રિવેદી (માહિતી) ગાંધીનગર | વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોથી પ્રેરાઈને વડોદરાની ૨૪ વર્ષીય વિદ્યાર્થીની ગામની સરપંચ બની છે. હાલમાં સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી, ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે. સરપંચ બનતાની સાથે તેમણે ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી દીધી છે.

વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ શ્રી કલ્પનાબેન ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલા કલ્પનાબેનને ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ અને બીકીમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ તાજેતાજ બહાર આવ્યા હતા.



કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, મારા પિતા કાંતિભાઈ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. વળી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે નેતૃત્વનો એક સશક્ત અને સ્વચ્છ ચહેરો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તેનાથી પ્રેરાઈને સરપંચ બનવાનું નક્કી કર્યું. પિતાનો સહયોગ મળ્યો. ગામ લોકોનો ટેકો મળ્યો. સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા

કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. તે કહે છે, અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને ૨૬૦થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મુકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે. દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે. ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમારે ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક યત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે.

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાં માત્ર કલ્પનાબેનને જ આમંત્રણ મળ્યું હતું. દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મુકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે. દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે. ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમારે ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક યત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે.

વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં ૨૫૯ રનના સ્કોર પર ઓલઆઉટ

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું, કોનવેએ ૧૪૧ બોલનો સામનો કર્યો અને ૭૬ રન બનાવ્યા



। (એજન્સી) પુણે, તા.૨૪ । ન્યૂઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં ૨૫૯ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે. તેણે ૨૩.૧ ઓવરમાં ૫૯ રન આપીને ૭ વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ ૧૪૧ બોલનો સામનો કર્યો અને ૭૬ રન બનાવ્યા.

રવિન્દ્રએ ૬૫ રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં પસંદ ન થયેલા વોશિંગ્ટન સુંદરને અચાનક બીજી ટીમમાં બોલાવવામાં આવ્યો હતો અને તેને પ્લેઈઝ-૧માં પણ સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સુંદરે સાત વિકેટ લઈને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. તેણે ૨૩.૧ ઓવરમાં ૫૯ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જેમાંથી તેણે પાંચ ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા. એક એલબીડબલ્યુ અને એક કેચ આઉટ થયો હતો. બાકીની ત્રણ વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી હતી. સુંદરે રચિન રવિન્દ્ર, ડેવિડ મિશેલ, ટોમ બ્લેન્ડલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને મિશેલ સેન્ટનરને આઉટ કર્યા છે. આ સાથે જ અશ્વિને કેપ્ટન ટોમ લાથમ, વિલ યંગ અને ડેવોન કોનવેને પેવેલિયન મોકલી દીધા હતા. કોનવેએ સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા. જ્યારે

રચિન રવિન્દ્રએ ૬૫ રન બનાવ્યા હતા. આ બે સિવાય ૩૫ રનના આંકડાને કોઈ સ્પર્શી શક્યું નથી. લાથમ ૧૫ રન, વિલ યંગ ૧૮ રન, ડેવિડ મિશેલ ૧૮ રન, ટોમ બ્લેન્ડલ ત્રણ રન, ગ્લેન ફિલિપ્સ નવ રન, ટિમ સાઉથી પાંચ રન અને એજાઝ પટેલ ચાર રન બનાવીને આઉટ થયા હતા. આ સુંદરનો બેસ્ટ સ્પેલ હતો. આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનરોએ પ્રથમ દાવમાં વિરોધી ટીમના તમામ ૧૦ બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ વર્ષે બીજી વખત આતું બન્યું છે. અગાઉ ધર્મશાળામાં ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં તમામ ૧૦ વિકેટ ઝડપી હતી. હાલમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ કિંગ પર છે.

ન્યૂઝ ફ્રંક હવે એક સાથે ૮૫ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૪ । વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે ૮૫ વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે. તેમાં એર ઈન્ડિયાના ૨૦ વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે, તેમાં ૨૦ ઈન્ડિગો, ૨૦ વિસ્તાર અને ૨૫ અકાસા એરની ફ્લાઈટ્સ સામેલ છે. ન્યૂઝ એજન્સીના અનુસાર, આ પહેલા દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં ૮૦થી વધુ રોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે આઠ અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઈ છે. જે ફ્લાઈટ્સને ધમકી મળી છે, તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારની સેવાઓ સામેલ છે. આ ફ્લાઈટ દિલ્હીથી અલગ અલગ રોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સેવાઓ માટે સંચાલિત થાય છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તપાસ ચાલી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના અનુસાર, ધમકી ભર્યા મેસેજ ૬ પર મળ્યા હતા જ્યારબાદ અધિકારીઓએ તેને ફગાવી દીધા. પહેલો કિસ્સો ૧૬ ઓક્ટોબરે બેંગ્લુરુ જરનારી અકાસાની ફ્લાઈટને નિશાન બનાવવાથી જોડાયેલ હતો. ઠના માધ્યમથી મળેલી બોમ્બની ધમકી બાદ ફરિયાદ દાખલ કરાઈ હતી.

તુર્કીએ આતંકી હુમલાનો ઈઝરાયલની જેમ બદલો લીધો

। (એજન્સી) અંકારા, તા.૨૪ । તુર્કીની રાજધાની અંકારામાં બુધવારે થયેલા બીપણ આતંકવાદી હુમલાના જવાબમાં બે પાડોશી ઈસ્લામિક દેશને નિશાનો બનાવવામાં આવ્યા છે. તુર્કીએ પાડોશી દેશ સીરિયા અને ઈરાકમાં એર સ્ટ્રાઈક કરી છે. તુર્કી તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે આતંકવાદીઓ ઠાર કર્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે. તુર્કી રક્ષા મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલાં નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે, હવાઈ હુમલો કરી કુલ ૩૦ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. તુર્કીએના રાષ્ટ્રપતિ રઝવ તૈય્યબે એઈઆનના એરોસ્પેસ અને ડિકેન્સ કંપની 'તુસાસ' પર હુમલાને લઈને કહ્યું કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે. રાષ્ટ્રપતિના આ નિવેદનના થોડા સમય બાદ જ તુર્કીએ સીરિયા અને ઈરાક પર હવાઈ હુમલો કરાવી દીધો. તુર્કીએ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું કે, એક મહિલા સહિત ત્રણ હુમલાખોર એક ટેક્સીમાં એરોસ્પેસ અને ડિકેન્સ કંપની તુસાસ કેમ્પસના પ્રવેશ દાર પર પહોંચ્યા હતાં. હુમલાખોરો હુમલો કરવા હથિયાર સાથે લઈને આવ્યા હતા. તેઓએ ટેક્સીની બાજુમાં એક વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ કર્યો, જેનાથી અફરાતફરી મચી ગઈ અને તે પરિસરમાં ઘુસી ગયાં.

જસ્ટિસ ટૂડોએ લીધો મોટો નિર્ણય કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ

વડાપ્રધાન જસ્ટિસ ટૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવાના છીએ । (એજન્સી) ઓટાવા, તા.૨૪ । છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ માટે ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડોને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા છે. હવે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડોએ એક નવી જાહેરાત કરી છે. જે કેનેડામાં રહેતા ઈમિગ્રન્ટ ભારતીયો માટે મોટી મુશ્કેલીનું કારણ બની છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે



પહેલા કેનેડાના કર્મચારીઓને કેમ નિયુક્ત નથી કરી શકતા." ભારતીય ઈમિગ્રન્ટ કામદારો અને વિદ્યાર્થીઓને પહેલેથી જ ઓછી પ્લેસમેન્ટ મળવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને ટૂડોની આ જાહેરાત પછી સ્થિતિ વધુ ખરાબ થશે. વડાપ્રધાન જસ્ટિસ ટૂડોની લિબરલ સરકાર ઘણા વર્ષો પછી પ્રથમ વખત દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સની નિયમો લાવી રહ્યા છીએ, જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ

ગ્રેનેડ બ્લાસ્ટમાં એક પોલીસ જવાન ઘાયલ જમ્મુ-કશ્મીરમાં મલખાના કોર્ટ પરિસરમાં અચાનક ઘડાકો થયો ઉત્તર કાશમીરના બારામુલાના મલખાના કોર્ટના પરિસરમાં લગભગ એક વાગ્યેને પાંચ મિનિટે આ પ્રકારની ઘટના બની

। (એજન્સી) જમ્મુ, તા.૨૪ । જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગ્રેનેટ વિસ્ફોટ થતા અફરાતફરી મચી છે. જિલ્લાના મલખાના કોર્ટ પરિસરમાં અચાનક ઘડાકો થયો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઉત્તર કાશ્મીરના બારામુલાના મલખાના કોર્ટ પરિસરમાં આજે લગભગ એક વાગ્યેને પાંચ મિનિટે આ ઘટના બની



છે, જેમાં ભૂલથી ગ્રેનેટ વિસ્ફોટ થતાં ડ્યુટી પર તહેનાત એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે કે, તેઓ અફવા પર ધ્યાન ન આપે. જમ્મુ-કાશ્મીરની વધુ એક ઘટનાની વાત કરીએ તો અહીંના બટાગુંડ ત્રાલમાં બિન-કાશ્મીરી લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. અહીં ગોળીબારની બનેલી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. તેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ પ્રકારનો ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં એક શખસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

CBSEએ પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાની તારીખો કરી જાહેર CBSE ધોરણ ૧૦-૧૨ માટે મહત્વના સમાચાર, પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૫ નવેમ્બરથી ૫ ડિસે. વચ્ચે યોજાશે

। (એજન્સી) મુંબઈ, તા.૨૪ । સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. સીબીએસઈએ વર્ષ ૨૦૨૩ અને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે ધો. ૧૦ અને ધોરણ-૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા પહેલી જાન્યુઆરીથી જ્યારે થિયરી પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી લેવામાં આવશે. જોકે, પરીક્ષા ક્યારે, ક્યા દિવસે, ક્યા વિષયોની લેવાશે તે અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આ માટે વિદ્યાર્થીઓએ ધો. ૧૦-૧૨ની ડેટશીટ જાહેર થવાની રાહ જોવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ છે કે, શિયાળાની શાળાઓ માટે CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ પાંચમી નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે યોજાશે. આ માહિતી બોર્ડ દ્વારા પહેલાથી જ અપાઈ હતી. આ પછી હવે બોર્ડે અન્ય શાળાઓની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. સીબીએસઈએ વર્ષ ૨૦૨૩ અને વર્ષ ૨૦૨૪માં ડિસેમ્બરમાં પરીક્ષામાં ટાઈટબલ જાહેર કર્યું હતું, તેથી આ વર્ષે જાન્યુઆરીથી જ્યારે થિયરી પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી લેવામાં આવશે. જોકે, પરીક્ષા ક્યારે, ક્યા દિવસે, ક્યા વિષયોની લેવાશે તે અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આ માટે વિદ્યાર્થીઓએ ધો. ૧૦-૧૨ની ડેટશીટ જાહેર થવાની રાહ જોવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ છે કે, શિયાળાની શાળાઓ માટે CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કર્યો હતો. તેમાં એવું પણ જણાવાયું હતું કે, જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં. CBSEએ એવો પણ દાવો કર્યો છે કે, ૨૦૨૫માં આશરે ૪૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ ૧૦-૧૨ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ બિના થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરીક્ષાર્થીઓ સરળતાથી ઓનલાઈન ડેટશીટ ડાઉનલોડ કરી શકે છે. આ માટે તમારે સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ સીબીએસઈ ધોરણ-૧૦ ડેટ શીટ ૨૦૨૫ / સીબીએસઈ ધોરણ-૧૨ ડેટ શીટ ૨૦૨૫ લિંક પર ક્લિક કરવાની રહેશે. આપને સ્કીન પર એક PDF જોવા મળશે, જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાનો વિવાદ વકર્યો

। (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪ । સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાનો વિવાદ બિન્દો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ આ પ્રતિમા પર નારાજગી વ્યક્ત કરી છે. એક પ્રસ્તાવ પસાર કરી એસોસિએશને કહ્યું કે, અમારી સાથે ચર્ચા કર્યા વિના પ્રતિમામાં એકતરફી બદલાવ કરવામાં આવ્યો છે. મંગળવારે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સિનિયર વકીલ કપિલ સિંબલની અધ્યક્ષતાવાળી SCBAએ સુપ્રીમ કોર્ટના પ્રતીક અને નવી પ્રતિમામાં બદલાવોનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, નવી પ્રતિમામાં આંખો પરથી પાટો બાંધેલી લેડી જસ્ટિસને ખુલ્લી આંખો સાથે દર્શાવવામાં આવી છે. તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ દર્શાવવામાં આવ્યું છે. SCBA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ઠરાવમાં કહ્યું છે કે અમે ન્યાયના વહીવટમાં સમાન હિસ્સેદાર છીએ, પરંતુ અમને ફેરફારો વિશે જાણ કરવામાં આવી ન હતી. તેમજ આ ફેરફારો પાછળનો તર્ક પણ સમજાવવામાં આવ્યો ન હતો.

પાકિસ્તાની હિન્દુઓની દિવાળી સુધરી ગઈ સરકારે ૩-૩ હજાર આપવાનું કર્યું એલાન, ત્રણ દિવસની રજા પણ મળશે પંજાબ કેબિનેટે તહેવાર કાર્ડ પહેલને મંજૂરી આપી દીધી

। (એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૨૪ । એક બાજુ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચારો ખૂબ જ સામાન્ય છે, તો બીજી બાજુ હવે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાલે તેમના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મરિયમ નવાલ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની પંજાબ સરકાર ગુરુ નાનક જયંતિ અને દિવાળી પહેલા રાજ્યના ૨,૨૦૦ શીખ અને હિન્દુ પરિવારોને ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા (ભારતના લગભગ ૩ હજાર) આપશે. આ ઉપરાંત બલુચિસ્તાન સરકારે પણ મોટું એલાન કરતા દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે ૩ દિવસની રજાની જાહેરાત કરી છે. એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, 'મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આપણા હિન્દુ અને શીખ ભાઈઓને તહેવાર કાર્ડ વહેંચવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દો. આ વર્ષની શરૂઆતથી આ ૨,૨૦૦ પરિવારોને 'તહેવાર કાર્ડ' કાર્યક્રમના તીર્થયાત્રીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.



વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ શીખવડાતાં જ શિક્ષકની કરતૂતનો ભાંડો ફૂટ્યો

। (એજન્સી) લખનૌ, તા. ૨૪ । એક સ્કૂલ શિક્ષકની કથિત યોન શોષણના આરોપ માં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાની પ્રાથમિક શાળાનો છે. શાળાના શિક્ષિકા વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહ્યાં હતા. ત્યારે તે વિદ્યાર્થીનીઓએ કહ્યું કે 'આનું બેડ ટચ તો તે શિક્ષક કરે છે.' આ તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ ૧ થી ૩ ની છે. તેમને શું ખબર હતી કે એક શિક્ષક પણ ખોટું કરી શકે છે. પ્રાથમિક શાળાના શિક્ષક લાંબા સમયથી માસૂમ વિદ્યાર્થીઓનું યોન શોષણ કરી રહ્યાં હતા પરંતુ વિદ્યાર્થીનીઓ શિક્ષકની હરકતને સમજ શકી નહીં જ્યારે શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચનો અર્થ સમજાવ્યો તો તમામ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ બધું તેમની સાથે દરરોજ તેમના શિક્ષક કરે છે તો શાળામાં હોબાળો મચી ગયો. ઘટનાની જાણકારી ગ્રામજનોને થઈ તો વધુ હોબાળો મચ્યો. ગ્રામ પ્રધાને જણાવ્યું કે 'સમગ્ર મામલાની જાણકારી શિક્ષણ વિભાગના અધિકારીઓને થઈ તો ઉચ્ચ અધિકારીઓએ પણ મામલાને રફેંદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગ્રામજનોએ બાળકોની સુરક્ષાની માગ અને આરોપી પર કાર્યવાહીને લઈને પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. આ મામલે શિક્ષણ વિભાગ આરોપી શિક્ષક પર આકરી કાર્યવાહી કરવાના બદલે તેની પર મહેરબાની કરતું નજર આવી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ બાબડયાં SEBI પ્રમુખ માધબી બુચ સંસદીય સમિતિની બેઠકમાં હાજર ન રહ્યા SEBI ના વડા માધબી પુરી બુચે પોતે સૂચના આપી હતી કે, અંગત કારણોસર તે દિલ્હી પહોંચી શકશે નહીં

। (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪ । SEBI ના વડા માધબી પુરી બુચની ગેરહાજરીના કારણે સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટીની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. PAC ના હેડ કેસી વેણુગોપાલે આ અંગે જાણકારી આપી હતી કે, માધબી પુરી બુચની ગેરહાજરીના કારણે કમિટીની આજની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. બુચે પોતે સૂચના આપી હતી કે, અંગત કારણોસર તે દિલ્હી પહોંચી શકશે નહીં. PAC ની પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પહેલા વિષય રૂપે અમે રેગ્યુલેટરી સંસ્થાઓની સમીક્ષા કરીશું. જેના ભાગરૂપે આજે આયોજિત બેઠકમાં સેબીના વડાને સમીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. વેણુગોપાલે જણાવ્યું હતું કે, કમિટીની આ સમીક્ષામાં સેબીના વડાએ ઉપસ્થિતિમાં છૂટ આપવાની માગ કરી હતી. પરંતુ અમે તેનો ઈનકાર કર્યો હતો. બાદમાં ખાતરી કરવામાં આવી હતી કે, તે કમિટી સમક્ષ હાજર રહેશે. આજે સાડા નવ વાગ્યે સેબીના વડા અને સેબીના અન્ય સભ્યોએ અમને સૂચના આપી કે, અંગત કારણોસર તે દિલ્હીની યાત્રા કરી શકશે નહીં. PAC ના ચેરમેનની ફરિયાદ કરવા એનડીએના સાંસદ લોકસભા સ્પીકર સમક્ષ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, કેસી વેણુગોપાલનો ઈરાદો દેશના નાણાકીય ઢાંચાને તોડવાનો છે. આ સંદર્ભે થોડા સમય પહેલાં જ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો કે, માધબી બુચને બોલાવવાનો PACને કોઈ અધિકાર નથી. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર, દરેક સર્વિન્ટંગ કમિટી તે વિભાગ સંબંધિત રેગ્યુલેટરી કમિટીની સમીક્ષા કરે છે.



તંત્રી લેખ...



ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર

વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતું અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતું અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે ગ્રામ્ય માગમાં રિકવરીના ટેકા સાથે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા અમારો અંદાજ છે. ખાધાખોરાકીના ભાવમાં સામાન્યતા સાથે વર્તમાન નાણાં વર્ષમાં કુગાવો ઘટી ૪.૪૦ ટકા રહેવા અપેક્ષા હોવાનું આઈએમએફ એશિયા પેસિફિક રીપોર્ટમેન્ટના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું. ચૂંટણીઓ છતાં, રાજકોપિય શિસ્તતા તેના પંથે છે. રિઝર્વનું સ્તર સારું છે. ભારત માટે મેક્રો ફન્ડામેન્ટલ્સ સારા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી બાદ ભારતમાં સુધારા અગ્રતાઓ ત્રણ ક્ષેત્રોમાં હોવી જરૂરી છે. ભારતમાં રોજગાર નિર્માણ એક મુદ્દો રહેલો છે. આ સંદર્ભમાં મને લાગે છે કે, શ્રમ કાયદાનો અમલ થવો જરૂરી છે, કારણ કે તેનાથી લેબર માર્કેટમાં લવચિકતા જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું. જો તમારે સ્પર્ધાત્મક બનવું હશે તો, હાલની કેટલીક વેપાર મર્યાદાઓ દૂર કરવાની રહેશે. આ ઉપરાંત માળખાકીય સુધારા પણ ચાલુ રાખવાના રહેશે એટલું જ નહીં કૃષિ તથા જમીન સુધારા પર પણ ધ્યાન આપવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષણ તથા સ્કિલિંગ સંદર્ભે પણ વિચારવાનું તેમણે સૂચન કર્યું હતું. કાર્યબળમાં કુશળતા લાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર પર ભાર આપતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, કોઈ અર્થતંત્ર જે સેવા ક્ષેત્રમાં બહુબધા રોજગાર નિર્માણ કરી શકે છે ત્યાં, ખરા પ્રકારની કુશળતા હોવી મહત્વની છે. માટે શિક્ષણ તથા કાર્યબળમાં કુશળતા પાછા ઈન્વેસ્ટ કરવાનું ઘણું જ જરૂરી છે.

ભારત ડાયાબિટીસને લઈને બેહદ ખતરનાક વળાંક પર આવી ઊભું છે

મુદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન, આઈસીએમ આરની શોધ અનુસાર ચિન્સ, ફૂકડી, કેક, ક્રાઈડ ફૂડ અને મેયોનીઝ જેવી ચીજોના સેવનથી ડાયાબિટીસનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે અલ્ટ્રા પ્રોસેસડ ફૂડને કારણે ભારત ડાયાબિટીસની રાજધાની બનતું જાય છે. ભારતની લગભગ ૮.૨૯ કરોડ વયસ્ક આબાદીના ૮.૮ ટકા હિસ્સો ડાયાબિટીસની ચપેટમાં છે. અનુમાન છે કે ૨૦૪૫ સુધી આ સંખ્યા ૧૩ કરોડથી વધારે થઈ જશે. આ એ સમય હશે, જ્યારે બુનુગોની સંખ્યા પણ વધેલી હશે. ડાયાબિટીસ આમ તો એક રોગ છે, પરંતુ તેનાથી દર્દીઓનાં બિસ્સા પણ ખાલી થઈ રહ્યાં છે અને માનવ સંસાધનની કાર્યક્ષમતા પર વિપરીત અસર પડી રહી છે. સરકારી આંકડા અનુસાર ભારતમાં લોકોએ એક વર્ષમાં ડાયાબિટીસ કે તેનાથી પેદા થયેલ બીમારીઓ પર સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા જે આપણા વાર્ષિક બજેટના ૧૦ ટકા છે. છેલ્લા બે દાયકામાં આ બીમારીથી ગ્રસ્ત લોકોની સંખ્યામાં ૬૫ ટકાનો વધારો બેહદ ચિંતાજનક છે. દુભાગ્યપૂર્ણ છે કે આ રોગ હાલમાં ચિકિત્સા જગત માટે માત્ર કમાણીનો રસ્તો છે. જાતભાતનાં ડાયાબિટીસ મોનિટર, હજારો પ્રકારની એલોપેથિક-આયુર્વેદિક દવાઓ અને નુસખા વેચવામાં આવે છે. લંડનમાં તો કોઈને ડાયાબિટીસ હોય તો આખા પરિવારની સારવાર મફત છે. ભારતમાં એવો કોઈ સંવેદનશીલ દષ્ટિકોણ નથી. એક અનુમાન છે કે એક ડાયાબિટીસ દર્દીએ સરેરાશ ૪૨૦૦થી ૫૦૦૦ રૂપિયા દવા પર ખર્ચ કરવા પડે છે. આ રોગ ગ્રામીણ, ગરીબ વસ્તીઓ અને ત્રીસ વર્ષ સુધીના યુવાઓને પણ શિકાર બનાવી રહ્યો છે. ડાયાબિટીસ ખરાબ જીવનશૈલીથી પેદા થનારો રોગ છે, એટલે જ બેરોજગારી, વધુ ભૌતિક સુખ જોડવાની આંધળી દૌટ લોકોમાં શર્કરાની માત્રા વધારી રહી છે, કુખોષણ, નિમ્ન ગુણવત્તાવાળું પેકડ ભોજન પણ દર્દીઓની સંખ્યા વધારવાનું મોટું કારક છે. લેહ-લદાખ પહાડી વિસ્તાર છે, જ્યાં લોક ખૂબ પગપાળા ચાલતા હતા, મહેનત કરતા હતા, એટલે ક્યારેય બીમાર નહોતા થતા. છેલ્લા કેટલાક દાયકામાં ત્યાં બાહ્ય પ્રભાવ અને પર્યટકો વધ્યા. બાહ્ય દબલને કારણે અહીં ખાંડનો ઉપયોગ થવા લાગ્યો. હવે અહીં ડાયાબિટીસ જેવા રોગ ઘર કરી રહ્યા છે. દવા કંપની સનોફી ઈન્ડિયાના એક સર્વેમાં ડરામણા તથ્ય સામે આવ્યા છે કે ડાયાબિટીસની ઝપટમાં આવેલા લોકોમાંથી ૧૪.૪ ટકા લોકોને કિડની અને ૧૩.૧ ટકાને આંખોની રોશની જવાનો રોગ લાગી જાય છે, ૧૪.૪ ટકા દર્દીઓના પગની ધમનીઓ જવાબ દઈ જાય છે, જેનાથી તેમના પગ ખરાબ થઈ જાય છે અને લગભગ ૨૦ ટકા લોકો હૃદયની કોઈ બીમારીની ઝપટમાં આવી જાય છે. એટલું જ નહીં, ૬.૯ ટકા લોકોને ન્યૂરો એટલે કે તંત્રિકા સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ થાય છે. અમેરિકાની માનક સંસ્થાઓએ ભારતમાં લોકોમાં શર્કરાની માત્રાને કંઈક વધુ નોંધાવી છે, જેનાથી પ્રી-ડાયાબિટીસવાળા પણ દવાઓના ચક્કરમાં પડી જાય છે. એ બધા જાણે છે કે એક વખત ડાયાબિટીસ થઈ જાય તો દર્દીએ જિંદગીભર દવા લેવી પડે છે. ડાયાબિટીસ નિયંત્રણની સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની દવાઓ લેવી સામાન્ય વાત છે. કિડની બચાવવાની દવા પણ લેવી પડશે. જ્યારે આટલી બધી દવા લેવી પડે તો પેટમાં બનનારા એસિડના નાશ માટે પણ દવા જ લેવી પડશે, જેને નિયંત્રિત કરવા માટે પાછું કોઈ મલ્ટી-વિટામિન પણ અનિવાર્ય છે! એક સાથે આટલી બધી દવાઓ લીધા બાદ લીવર પર અસર તો પડશે જ. તેમાં શુગર માપનારાં મશીનો અને અલગ-અલગ ટેસ્ટ તો હજુ ઉમેર્યા જ નથી. ગામડાંની તો વાત છોડો, નગર-મહાનગરોમાં એવી હજારો લેબ છે જેના ટેસ્ટ રિપોર્ટ શંકાસ્પદ હોય છે. વડાપ્રધાન આરોગ્ય યોજના અંતર્ગત સારવારની નિ:શુલ્ક સેવાસ્થામાં ડાયાબિટીસ જેવા રોગો માટે સ્થાન નથી! સ્વાસ્થ્ય સેવાઓની જર્જરતાનો નમૂનો સરકારની સૌથી પ્રીમિયમ સ્વાસ્થ્ય યોજના સીજીએચએસ એટલે કે કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવા છે, જે અંતર્ગત પત્રકાર, પૂર્વ સાંસદ વગેરે પણ આવે છે. તે અંતર્ગત નોંધાયેલા લોકોમાં ચાલોસ ટકા ડાયાબિટીસના દર્દી છે અને તેઓ દર મહિને માત્ર નિયમિત દવા લેવા જાય છે. દર્દી ડોક્ટર પાસે જાય છે અને તેને કોઈ વિશેષણ પાસે મોકલવામાં આવે છે. વિશેષણ કોઈ ટેસ્ટ કરાવી આપે છે અને દર્દીએ ફરીથી દવાખાનામાં આવીને તેપાસ લખાવવાની હોય છે.

સુંદર અને સુશીલ નારી સર્જનહારની સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ છે, સ્ત્રી એ આ અવનિ પરનું જીવનું જાગતું કાવ્ય છે, કવિતા છે!

રમા એટલે એક એવી સ્ત્રી, કે જે મંગલકારી છે, હિતકારી અને પ્રિતકારી છે, રમા એકાદશીની કથા ચિંતામંઈ તુલ્ય છે



સંદગુરુ વઘાણીમૂલ સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ આનંદ માણે છે, જેની એક આંખમાં વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે, તેનું નામ સ્ત્રી, સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે: સ્નેહ, સમર્પણ અને સહનશીલતા, સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે, સ્ત્રીની સાચી શોભા અલંકારમાં નહિ, સદગુણોમાં છે. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા અને પ્રતીક્ષા ઈશ્વર પાર્વતી દિવાળીનાં દિવસોમાં ફરવા નીકળે, અને જેનાં ઘરે ઘર સાફ સુથરુ, અને દીવા મુક્યા હોય, આંગણામાં દીપ પ્રગટતા હોય, એને ઘેર ઈશ્વર કાયમ વસે છે. એટલે આપણે આવું બધું કરવાનું હોય, અને એ વાત ગાંઠ બાંધીને યાદ રાખી છે, તે આજ સુધી એ પરંપરા ચાલે છે. સાસરીના ઘરમાં પણ વડીલોની ધર્મ કર્મની ઉદાર મનો ભાવના એ જીવનરતની રંગોળીમાં પરોપકારનો એક વૈવિધ્ય પૂર્ણ રંગ જાળવી શકાયો છે, અને એમાં પણ એવાં જ ઉચ્ચ વિચારો હોવાથી બધું બેલેન્સ થાય છે. તો રમા એટલે સ્ત્રી અને એને લઈને પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે એક દંતકથા પ્રચલિત છે, તો આજે આપણે એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરીશું.



એકવાર ભગવાન શ્રીકૃષ્ણને યુધિષ્ઠિર બંને વચ્ચે સ્ત્રી વિશે ચર્ચા ચાલી કે સ્ત્રી કોને કહીશું, અને યુધિષ્ઠિરે સ્ત્રીની જે ઉત્કૃષ્ટ વ્યાખ્યા આપી છે, એ યુધિષ્ઠિરના શબ્દોમાં કહીએ તો આ મુજબ છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ આનંદ માણે છે, જેની એક આંખમાં વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે, તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે: સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. સ્ત્રીની સાચી શોભા અલંકારમાં નહિ, સદગુણોમાં છે. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા અને પ્રતીક્ષા ઈશ્વર પાર્વતી દિવાળીનાં દિવસોમાં ફરવા નીકળે, અને જેનાં ઘરે ઘર સાફ સુથરુ, અને દીવા મુક્યા હોય, આંગણામાં દીપ પ્રગટતા હોય, એને ઘેર ઈશ્વર કાયમ વસે છે. એટલે આપણે આવું બધું કરવાનું હોય, અને એ વાત ગાંઠ બાંધીને યાદ રાખી છે, તે આજ સુધી એ પરંપરા ચાલે છે. સાસરીના ઘરમાં પણ વડીલોની ધર્મ કર્મની ઉદાર મનો ભાવના એ જીવનરતની રંગોળીમાં પરોપકારનો એક વૈવિધ્ય પૂર્ણ રંગ જાળવી શકાયો છે, અને એમાં પણ એવાં જ ઉચ્ચ વિચારો હોવાથી બધું બેલેન્સ થાય છે. તો રમા એટલે સ્ત્રી અને એને લઈને પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે એક દંતકથા પ્રચલિત છે, તો આજે આપણે એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરીશું.

બાકી રહેતું નથી. સમાજનો એકોએક વ્યક્તિ લગભગ આ સત્યને જાણે પણ છે, અને માને પણ છે. પરંતુ જાહેરમાં કોઈ આ વાત પોતાના અહમને કારણે સ્વીકારી શકતા નથી. ઈશ્વરની ઉત્કૃષ્ટ રચના તરીકે સ્ત્રીને ગણવામાં આવી છે, અને દેહાકૃતિની દ્રષ્ટિએ સુંદર હોય કે ના હોય, પણ સ્ત્રીમાં અમુક ગુણો તો હોય જ છે, અને એ સૌ કોઈએ સ્વીકારી લેવા જેવી વાત છે. તો ખરેખર જીવન ધન્ય બને, અને ઘર સંસાર તો સ્ત્રીથી જ શક્ય છે એમાં કોઈ બેમત નથી. પૂર્વ મુચુકુંદ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ઈન્દ્રનો પરમ મિત્ર હતો. આ વિષ્ણુ ભક્ત કુબેર, યમ, વિભીષણ વગેરેનો પણ મિત્ર હતો. તેની પુત્રી ચંદ્રભાગા રાહકુમાર શોભનને પરણી હતી. એક વખત શોભન શ્વસુરગૃહે આવ્યો. રાજાએ સૌને ઢોલ પીટાવીને આસો વદ દસમના દિવસે આદેશ આપ્યો હતો કે એકાદશીનું વ્રત ફરજિયાત કરવાનું છે, શોભન એ પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ, પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઈન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી. મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું, અને વ્રતના પ્રભાવથી તેને દેવી સુખ પ્રાપ્ત થયું હતું, અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથા ચિંતામંઈ તુલ્ય છે.

માણસ નાપુશ રહે છે કારણ કે તે પોતાનું ઘર, શહેર, દેશ, મિત્રો, સંબંધો બધું જ બદલી નાખે છે પણ સ્વભાવ બદલી શકતો નથી

મોટા બલિદાન વિના મોટા લક્ષ્યો પ્રાપ્ત થતા નથી, અનેક મારામારી સહન કર્યા પછી પથ્થરની અંદર છુપાયેલ ભગવાનનું સ્વરૂપ દેખાય છે



વિશેષ ચણપાલસિંહ દી. વાઘેલા (દરબાર ગઢ, ઘરા)

સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે મહાન ત્યાગ વિના મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય નથી, જો તમારા જીવનનું ઘ્યેય મહાન છે તો એ વિચાર છોડી દો કે તમે ત્યાગ અને સમર્પણ વિના તેને પ્રાપ્ત કરી શકશો, પાથો જેટલો ઊંડો હશે તેટલી ઊંચી અને વધુ ટકાઉ ધમારત હશે, વાજબી કિંમત ચૂકવ્યા વિના જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકાતું નથી. જેમ તમે કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જાઓ છો, તો તમને તેની વાજબી કિંમત ચૂકવ્યા પછી જ તે મળે છે. એ જ રીતે, આપણે જીવનમાં જે કંઈ હાંસલ કરીએ છીએ, તેના માટે આપણે કેટલીક કિંમત ચૂકવવી પડશે. મોટા બલિદાન વિના મોટા લક્ષ્યો પ્રાપ્ત થતા નથી. અનેક મારામારી સહન કર્યા પછી પથ્થરની અંદર છુપાયેલ ભગવાનનું સ્વરૂપ દેખાય છે. જો આપણે ટોચ પર પહોંચવું હોય તો રસ્તામાં કાંકરા અને પથ્થરને કારણે થતી પીડાને ભૂલી જવી પડશે. સુંદરતાનો અભાવ પણ



સારો સ્વભાવ સરભર કરે છે, પરંતુ જો સારા સ્વભાવની ઉણપ હોય તો તેને સુંદરતાથી ક્યારેય પુરી શકાતી નથી. ચહેરાની સુંદરતા પ્રકૃતિ પર નિર્ભર કરે છે પણ પ્રકૃતિની સુંદરતા તમારા વલણ પર આધારિત છે. જ્યારે ચહેરાની સુંદરતા માત્ર આંખોમાં પ્રતિબિંબિત ન થાય છે, ત્યારે પ્રકૃતિની સુંદરતા હૃદય સુધી પહોંચે છે. માણસ નાપુશ રહે છે કારણ કે તે પોતાનું ઘર, શહેર, દેશ, મિત્રો, સંબંધો બધું જ બદલી નાખે છે પણ સ્વભાવ બદલી શકતો નથી. જીવનનું સત્ય એ છે કે માણસ પોતાના સ્વભાવથી સુખી કે દુઃખી થાય છે. સારો સ્વભાવ વ્યક્તિને કોઈના દિલમાં ઉતારી દે છે, જ્યારે ખરાબ સ્વભાવ વ્યક્તિને કોઈના દિલમાં ઉતારી દે છે. તેથી, તમારા સ્વભાવ ને નરમ બનાવો જેથી તમારું સમગ્ર જીવન મધુરતાથી ભરાઈ જાય. જેનો સ્વભાવ મધુર હોય છે તેનું જીવન પણ મધુર બને છે. ચિંતાની સૌથી મોટી આડઅસર એ છે કે ચિંતા કરવાથી આવનારી સમસ્યાનું નિરાકરણ નથી આવતું પરંતુ વર્તમાનની શાંતિને ચોક્કસ પાલે બલેલ પહોંચાડે છે. જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવે છે પરંતુ ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું. ચિંતા આપણી વિચારવાની ક્ષમતાને અવરોધે છે અને આ અવરોધ આપણા દુ:ખનું મૂળ છે. ચિંતાથી પીડિત વ્યક્તિ એક વાર નહિ પણ ઘણીવાર મૃત્યુ પામે છે. તે માત્ર એક જ વાર નહીં પરંતુ જીવનભર બળે છે. જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય છે, ત્યારે તેને ઉકેલવા માટે વિચાર કરવો એ એકમાત્ર શાણો નિર્ણય છે. વિચારશીલ વ્યક્તિ માટે, કોઈક યા બીજી રીત ચોક્કસ પણ મળી જાય છે. તેની પાસે વિવેકબુદ્ધિ છે અને તે સમસ્યાથી ડરતો નથી પરંતુ મક્કમ રહે

છે. સમસ્યાનો સામનો કરવો એટલે અડધી સફળતા હાંસલ કરવી. તેથી, ચિંતામાં નહીં પણ ચિંતનમાં જીવન જીવતા શીખો, કારણ કે જ્યાં ચિંતન છે ત્યાં ચોક્કસ ઉકેલ છે અથવા ચોક્કસ માર્ગ છે. આદર ક્યારેય ઊંચીની શકાતો નથી પરંતુ તે સારા સ્વભાવ, સારા વર્તન અને સારા કાર્યો દ્વારા પ્રાપ્ત થાય છે. સમાજમાં જેને પણ સન્માન મળ્યું, તે તેમના ઉત્તમ વ્યક્તિત્વને કારણે જ મળ્યું. સંપત્તિ ઈનીનીને મેળવી શકાય છે પણ માન કદી મેળવી શકાતું નથી. આદરની ઈચ્છા અને આદરને પાત્ર કામ કરવા વચ્ચે ઘણો તફાવત છે. આદરની ઈચ્છા આપણે એ સારી વાત છે, પરંતુ આદરને પાત્ર કામ કરવાથી પણ વ્યક્તિ ખરેખર આદરનો હકદાર બને છે. જીવનમાં હંમેશા શ્રેષ્ઠ માર્ગ પર રહો. તમારી ઈમાનદારી પણ તમને સન્માનને પાત્ર બનાવશે. કામમાં કુશળ, વર્તનમાં સૌમ્ય અને સ્વભાવમાં હળવા બનતા શીખો, તો તમારે માન મારાગતું નહીં પડે, આપોઆપ પ્રાપ્ત થઈ જશે. જીવનમાં, હંમેશા સત્ય સાથે આગળ વધો. સમય સાથે નહીં. જેઓ પોતાના અંતઃકલિતો પ રવા કર્યા વિના સત્ય સાથે ચાલવાની હિંમત એકત્ર કરી શકે છે, એક દિવસ સમય પણ તેમની સાથે ચાલવા લાગે છે. સત્ય એ છે કે સત્યના માર્ગે ચાલનારાઓના હાથમાં જ સમય હોય છે. સમય સાથે ચાલવું સહેલું છે પણ સત્યની સાથે ચાલવું બહુ મુશ્કેલ છે. જેઓ સમયનું પાલન કરે છે તેઓ સમય આવે ત્યાં ભૂલી જાય છે, પરંતુ જેઓ સત્યને અનુસરે છે તેઓ તેમના કાર્યોથી પોતાને અમર કરે છે. હિંમત વગર સત્ય સાથે ચાલી શકાતું નથી. જે હિંમતવાન છે તે સત્યના માર્ગનો પ્રવાસી પણ છે. સમય સાથે આગળ વધવું એટલે કોઈની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વિના ભીડનો ભાગ બનવું. એક નિજીવ શરીર પણ તરંગોની તીવ્ર ગતિને કારણે હલનચલન કરી શકે છે. શસ્ત્રોની તાકાતનું માપ એ પ્રવાહો સામે આગળ વધતી વખતે લક્ષ્ય સુધી પહોંચવાનું છે. સત્યની ઈચ્છા રાખો, સત્યને અનુસરો, તમે અંતિમ સત્ય સુધી પહોંચી જશો. વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજે હવે ઝડપભરે વિકાસના વાવાઝોડા અને સ્વચ્છતા સભ્ય નોંધણી અભિયાન વચ્ચે દિવાળીના તહેવારો ઊજવવા માટે સજજ થઈ રહ્યા છીએ તો હૃદય મનને શાંત પ્રકૃતિવત રાખી તહેવારો નવું વર્ષ પરિવાર સાથે ઉજવવા પ્રયાન કરીએ તેવી પ્રાર્થના સહ અસ્તુ.

દિવાળી પાર્ટીમાં દુલ્હન બનીને પહોંચી ૭૦ વર્ષની અભિનેત્રી રેખા



મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સૌ કોઈ બોલિવૂડની પીટ અભિનેત્રી રેખા પર જોતા રહ્યા હતા

બોલીવૂડમાં દિવાળી પાર્ટીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવરગ્રીન એક્ટ્રેસ રેખા દુલ્હનની જેમ તૈયાર થઈને પહોંચી હતી. ૭૦ વર્ષની વયે પણ આ પીટ અભિનેત્રી ઘણી યુવા અભિનેત્રીઓ પર ટક્કર આપતી જોવા મળી હતી. મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સૌ કોઈ બોલિવૂડની પીટ અભિનેત્રી રેખા પર જોતા રહ્યા હતા. રેખા દિવાળીની પાર્ટીમાં દુલ્હનની જેમ પોશાક પહેરીને પહોંચી હતી. ઓરેન્જ કલરની બનારસી સાડીમાં રેખા સુંદરતાની રાણી જેવી લાગી રહી હતી. અભિનેત્રી લાલ લિપ સ્ટિક, માંગ ટીકા, કાનની બુટ્ટી અને ગજરા પહેરેલી દુલ્હનથી ઓછી દેખાતી હતી. આ સમયગાળા દરમિયાન રેખાએ મનીષ મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી છે. બાદમાં રેખાએ શબાના આઝમી સાથે પણ ઘણી પોઝ આપી હતી. શબાના આઝમી પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રેખા અને શબાના આઝમી પણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રેખાને જોઈને તે કહેવું મુશ્કેલ હતું કે તે ૭૦ વર્ષની છે. આજે પણ અભિનેત્રી કોઈપણ યુવા અભિનેત્રી જેટલી જ દમદાર દેખાતી હતી.

‘મિથ્યા’ વેબ સિરીઝની રિવેન્જ ડ્રામા સાથે કુરેશી ફરી સજ્જ થઈ વેબ સિરીઝની બીજી સિઝન આવી રહી છે, જેમાં હુમા કુરેશી અને અવંતિકા દાસાની અને નવા કસ્તુરિયા મુખ્ય રોલમાં

‘મિથ્યા - ધ ડાર્કર ચેટર’ વેબ સિરીઝની બીજી સિઝન આવી રહી છે, જેમાં હુમા કુરેશી અને અવંતિકા દાસાની અને નવા કસ્તુરિયા મુખ્ય રોલમાં છે. આ કલાકારો તેમની સિરીઝના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. હુમા આ સિરીઝમાં એક નવા રોલમાં જોવા મળશે, જેમાં બે સાવકી બહેનો જૂઠી એટલે કે હુમા કુરેશી અને રિયા એટલે કે અવંતિકા દાસાનીની વાત છે. તેમની વચ્ચે તેમની બદલો લેવાની ભાવના, તેમનાં અસ્થિર સંબંધો સાથે પ્રતિષેધની વાર્તા રજૂ કરે છે, જે સિરીઝ દિવાળીથી સ્ટ્રીમ થશે. મિથ્યામાં નવીન કસ્તુરિયા, રજિત કપૂર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, અવંતિકા અકેરકર, રુશદ રાણા, કિષ્કા બિષ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અમદાવાદની મુલાકાતે આવેલી હુમા કુરેશીએ ઉત્સાહ સાથે કહ્યું કે, “હું અમદાવાદની મુલાકાત અંગે હંમેશા રોમાંચિત હોઉં છું. મારી છેલ્લી ફિલ્મ અહીં શૂટ થઈ છે! અમદાવાદમાં શૂટિંગ માટે અનેક દિવસો વિતાવ્યા પછી, આ શહેર હવે મારા માટે એક પરિચિત સ્થળ બની ગયું છે. અમે ગુલાબી ફિલ્મનું શૂટિંગ પણ અહીં જ કર્યું હતું. હું આ શોમાં એક એવી વ્યક્તિ છું જે સંજોગોને કારણે સંવેદનશીલ બને છે અને વેર વાળે છે. આ ઉત્તેજક, અને આકર્ષક ભૂમિકા માટે મને પસંદ કરવા બદલ હું નિર્માતાઓની આભારી છું.”



ઐશ્વર્યા રાયના ઘરે પાર્ટીમાં વર્તાઈ અભિષેકની ગેરહાજરી

અમિતાભના જન્મદિવસના વીડિયોમાં સમાવિષ્ટ તસવીરોમાંથી ઐશ્વર્યા ગાયબ જોવા મળી હતી, છૂટાછેડાની અફવાને મળ્યો વેગ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેનો સંબંધ શરૂઆતથી જ દુનિયામાં ચર્ચાનો વિષય રહ્યો છે. લગ્નથી લઈને અત્યાર સુધી દાંપત્યજીવનમાં જે કંઈ બની રહ્યું છે તેના પર દરેકની નજર રહે છે. છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલો આવી રહ્યા છે. આ બંધુ ત્યારે શરૂ થયું જ્યારે ઐશ્વર્યા-અભિષેક અનંત-રાધિકાના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા. આ પછી, એક -બે વખત સિવાય ક્યારેય સાથે જોવા મળ્યા નથી. દરમિયાન મંગળવારે ઐશ્વર્યા રાય તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિષેક બચ્ચનથી છૂટાછેડાની અફવાઓ સામે ઝડૂમી રહેલી અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા

બચ્ચન અને તેની માતા બ્રિન્દા રાય સાથે એક ખાનગી જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી, પરંતુ પાર્ટીમાં અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. સામે આવેલા ફોટામાં ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા અને માતા બ્રિન્દા રાય સાથે જોવા મળી રહી છે. આ સિવાય તેના કેટલાક સંબંધીઓ પણ તેની સાથે જોવા મળ્યા હતા. ફોટોમાં આરાધ્યા તેની સ્કૂલની જર્સીમાં જોવા મળી રહી છે. આ ફોટો ઐશ્વર્યાના કઝીન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેની બંધેડ પાર્ટીમાં ઐશ્વર્યાએ હાજરી આપી હતી. ફોટો શેર કરતી વખતે, તેણે જન્મદિવસની શુભેચ્છાઓ માટે તેના મિત્રો અને અનુયાયીઓનો આભાર માન્યો. ઘણા યુઝર્સ પણ આ તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ ફોટામાં અભિનેત્રી અને તેના પરિવારના



કેટરીનાનું તેના સાસરિયાઓ સાથે બોલિંગ... બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને તેના સાસરિયાઓએ એક ખાસ નામ આપ્યું

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલમાંથી એક છે

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલમાંથી એક છે. આ જોડીએ ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. આ કપલને લગ્ન સુધી પોતાના સંબંધો વિશે મૌન સેવ્યું હતું અને લગ્ન બાદ પણ પોતાના લગ્નના ફોટા શેર કરીને ચાલકોને ખુશ કર્યા હતા. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ તેમની અદભૂત કેમેસ્ટ્રી અને એકબીજા પ્રત્યેના પ્રેમથી તેમના ચાલકોને ખુશ કરી રહ્યા છે. આ સેલિબ્રિટી કપલ માત્ર એકબીજા સાથે સારા સંબંધો જ નથી શેર કરતા, પરંતુ એકબીજાના પરિવારનો આદર કરે છે અને તેમના સાસરિયાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. કેટરિના કૈફ વિક્કી કૌશલના માતા-પિતા સાથે દરેક તહેવાર ઉજવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કરવા યોગ્યની તસવીરો શેર કરી હતી, જેમાં તેના પતિ વિક્કી સિવાય તે તેના સાસુ-સસરા સાથે પણ જોવા મળી હતી. વિક્કી કૌશલ પણ ઘણીવાર તેની પત્નીના પરિવાર સાથે જોવા મળે છે. વિક્કીનો પરિવાર પણ કેટરીનાને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીએ પોતે કૌશલ પરિવાર તરફથી

મળતા પ્રેમ વિશે ખુલીને વાત કરી છે. ૨૦૨૨માં કેટરીનાએ ખુલાસો કર્યો હતો કે તેના સાસુ-સસરા એટલે કે શામ કૌશલ અને વીણા કૌશલે પણ તેને ખૂબ જ સુંદર ઉપનામ આપ્યું છે. કેટરિનાએ આ વાતનો ખુલાસો ‘દ કપિલ શર્મા શો’ દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું કે તેના સાસરિયાઓએ તેને હુલામણું નામ આપ્યું છે અને તેને ‘કિટ્ટો’ કહે છે. અભિનેત્રી કહે છે- ‘મારા ઈન-લોઝ મને કિટ્ટો કહે છે.’ આ સાંભળીને એક્ટ્રેસ ‘ફોન ભૂત’ના કો-સ્ટાર ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત યતુવેદી હસવા લાગે છે. આ સાથે કેટરિનાએ એ પણ ખુલાસો કર્યો કે તેની સાસુ પણ તેના ડાયટનું પૂરુંપૂરું ધ્યાન રાખે છે. તેણી તેના માટે શકર્રીયા પણ રાંધે છે, જે તેના આહારનો એક ભાગ છે. આ વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું હતું કે, ‘શરૂઆતમાં મા મને પરાકા ખવડાવતી હતી અને હું ડાયેટ પર પછા જોવા મળી હતી. વિકી કૌશલ તેને પત્નીના પરિવાર સાથે જોવા મળે છે. વિકીનો પરિવાર પણ કેટરીનાને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીએ પોતે કૌશલ પરિવાર તરફથી



સુરક્ષાના કારણોસર સલમાનનો કેમિયો કેન્સલ થયો ‘સિંધમ અગેઇન’ ફિલ્મમાંથી ચુલબુલ પાંડેની એક્ટિંગ



મુંબઈમાં ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું, પરંતુ બાબા સિદ્દિકીની હત્યાને કારણે શૂટિંગ કેન્સલ

અજય દેવગનની ‘સિંધમ અગેઇન’ અંગે છેલ્લાં કેટલાક દિવસોથી નવી નવી અપડેટ્સ આવી રહી છે. તેમાં પણ સિંધમના કોપ યુનિવર્સમાં ચુલબુલ પાંડેની એન્ટ્રી અંગે ઘણી આતુરતા અને ઉત્સુકતા વધારવામાં આવી હતી. હવે સલમાન અને ખાસ કરીને ચુલબુલ પાંડેના ફેન્સ માટે નિરાશાજનક ખબર છે. હવે કેટલાક એવા અહેવાલો આવી રહ્યા છે કે હવે ‘સિંધમ અગેઇન’માં ચુલબુલ પાંડેની એન્ટ્રી જોવા મળશે નહીં. સુરક્ષાના કારણોસર ફિલ્મમાંથી સલમાનનો કેમિયો કેન્સલ થયો છે. આ અહેવાલો અનુસાર સલમાન હવે ફિલ્મનો ભાગ નથી. છેલ્લાં ઘણા સમયથી સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે, પણ સલમાને પીછેહઠ કરી ન હતી. બાબા સિદ્દિકીની હત્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, “મુંબઈમાં ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું. પરંતુ બાબા સિદ્દિકીની હત્યાને કારણે શૂટિંગ કેન્સલ થયું હતું. પછી અજય અને રોહિત શેઠી વચ્ચે એક અંગત ચર્ચા થઈ અને બંને એ નક્કી કર્યું કે આવા જોખમી અને વિવાદોના સમયે સલમાનને શૂટ માટે કહેવું અને અસંવેદનશીલ ગણાશે. અજય અને રોહિતની જોડી સેન્સર બોર્ડને ફિલ્મ સમયસર મોકલવાની ઉતાવળમાં હતી. તેથી તેમણે સલમાનના સીન વિના જ ફિલ્મ મોકલી દીધી.” જોકે, કેટલાક સૂત્રો એવું પણ જણાવે છે કે એવી પણ શક્યતા છે કે સલમાન સાથેનું શૂટ પાછળથી કરીને કદાચ ફિલ્મના અંત પછીના કેડિટ વખતે પણ સીન મુકવામાં આવે, જે હજુ આ અંગે ચિત્ર સ્પષ્ટ નથી. સૂત્રએ જણાવ્યું, “બાબા સિદ્દિકીના મૃત્યુના બે જ દિવસમાં સલમાનને શૂટ માટે કહેવું મુશ્કેલ હતું. રોહિત અને અજયે ૧૮ ઓક્ટોબર સુધીમાં આ ફિલ્મ સંભવિત કરવાની હતી. તેથી તેમણે સલમાનની અંગતતા જાળવી રાખવા માટે આ કૌતીન નિર્ણય લીધો.” અગાઉ સલમાને આ કેમિયો માટે હા પાડી હતી. આ સીન તે માત્ર અજય દેવગન અને રોહિત શેઠી સાથેના સંબંધોને કારણે જ કરી રહ્યો હતો.

‘પુષ્પા’માં સામંથાની જગ્યા શ્રદ્ધા લીધી

‘અન્ટવા વામા’ને ભરપૂર લોકપ્રિયતા મળી હતી, આ ગીત ખૂબ વખણાયું હતું

‘પુષ્પા - ધ રાઈઝ’ પછી હવે ‘પુષ્પા - ધ રુલ’ની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પહેલી ફિલ્મમાં સામંથાના સોંગ ‘અન્ટવા વામા’ને ભરપૂર લોકપ્રિયતા મળી હતી. આ ગીત ખૂબ વખણાયું હતું. તેનાથી સામંથા પણ એક સેન્સેશન બની ગઈ હતી. હવે એવી શક્યતાઓ છે કે સામંથાની જગ્યાએ શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં એક સ્પેશિયલ સોંગ કરશે. શ્રદ્ધા કપૂર આ પહેલાં તેલુગુ ફિલ્મ ‘સાહો’માં પ્રભાસ સાથે કામ કરી ચૂકી

છે, તેથી તેલુગુ ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સમાં તે પહેલાંથી જ જાણીતી છે. હવે ‘શ્રી ૨’ સફળતા પછી ફિલ્મના મેક્સ તેને પોતાની ફિલ્મમાં લેવા માગે છે, જેથી તેમની ફિલ્મને શ્રદ્ધાની પેન ઈન્ડિયા લોકપ્રિયતાનો લાભ થઈ શકે. આ ફિલ્મના બીજા ભાગમાં પણ અલ્લુ અર્જુનની હિરોઈન તો રશ્મિકા મંદાના જ રહેશે, જે ફરી શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. હવે શ્રદ્ધા જેવા લોકપ્રિય ચહેરાને લઈને મેક્સ સમગ્ર દેશમાં ફિલ્મની પહોંચ વધારવા માગે છે. તેઓ ઈચ્છે છે કે બીજી ફિલ્મનું સોંગ અન્ટવા વામાથી પણ વધુ લોકપ્રિય થાય. સાથે જ તેમની આશા છે કે આ ફિલ્મ પહેલા ભાગ કરતાં પણ વધુ કમાણી કરવામાં સફળ રહેશે. જોકે, શ્રદ્ધાની આ ફિલ્મમાં એન્ટ્રી અંગે હજુ ફિલ્મ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ દ્વારા કન્ફર્મશન આપાયું નથી.



લગ્નના ૯ વર્ષ બાદ તેને માતા બનવાનું સુખ મળ્યું દૃષ્ટિ ધામી ૩૯ વર્ષની ઇંમરે બની માતા

૩૯ વર્ષની ઇંમરે પ્રેગ્નન્સીના ૧૦મા મહિનામાં તેણે દીકરીને જન્મ આપ્યો

પુશખબર પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા. ૨૨ ઓક્ટોબરે તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રેગ્નન્સીના ૧૦મા મહિનામાં તેણે દીકરીને જન્મ આપ્યો, લગ્નના ૯ વર્ષ બાદ તેને માતા બનવાનું સુખ મળ્યું, અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો હતો, જેની સાથે તેણે તેના ચાલકોને તેની બાળકીના જન્મ વિશે માહિતી આપી હતી. તેણે વીડિયોની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું- ‘સ્વર્ગથી સીધા આપણા હૃદયમાં એક નવું જીવન, સંપૂર્ણપણે નવી શરૂઆત. પોસ્ટ કરીને ખુશી કરી વ્યક્ત, ૨૨.૧૦.૨૪ તે અહીં છે! ઉત્સાહિત માતા-પિતા દૃષ્ટિ અને નીરજ.’ માતા-પિતા બન્યા બાદ દૃષ્ટિ અને તેના પતિ નીરજ ખેમકા ખૂબ જ ખુશ છે.



શબાના આઝમી સાથે લગ્ન કર્યા ત્યારે ‘નશામાં’ હતા જાવેદ અખ્તર

એક્ટર અનુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને યાદ કર્યા

જાવેદ અખ્તરે ઘણી વખત પોતાની દારૂની લત વિશે વાત કરી છે. તેઓ માને છે કે તેમની પ્રથમ પત્ની હતી શબાના આઝમી. તેઓ તેમની સાથેના લગ્ન તૂટવાનું કારણ દારૂ પણ હતું. હવે એક્ટર અનુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શબાના સાથે લગ્ન સમયે પણ જાવેદ અખ્તર નશામાં હતા. અનુ કપૂરે જણાવ્યું કે તેઓ લગ્ન માટે અડધી રાત્રે મોલલીને બોલાવવા ગયા હતા. ANI પોડકાસ્ટમાં અનુ કપૂરને જાવેદ અને શબાના આઝમીના લગ્ન યાદ આવ્યા. કહ્યું, તેઓ (જાવેદ) ત્યાં બેઠા હતા અને નશામાં હતા. શબાના બીજે ક્યાંક બેસીને પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતા. હું ત્યાં હતો અને તેમને કહ્યું, બીબી, આગળ વધો, એકવાર નિર્ણય લો અને તેને પૂર્ણ કરો. જાવેદ નશામાં હતા. શબાનાએ



કહ્યું, ‘હું નિર્ણય કેવી રીતે લઉં, તેઓ પોતે નિર્ણય લેવા તૈયાર નથી.’ હું તેમની પાસે ગયો અને તેમને હલાવ્યા. તેમણે કહ્યું, હું તૈયાર છું. હું ડ્રાઈવર સાથે મોલલીને બોલવા દોડ્યો. દરમિયાન શોકત અમ્મી તેમનો લાલ જોડો લઈને આવ્યા. બોની કપૂર, અનિલ કપૂર અને બધાને બોલાવ્યા. સવારના ૪ વાગ્યા સુધી બધાએ ડાન્સ કર્યો અને અડધી રાત પછી લગ્ન થયા. શબાના આઝમીએ અગાઉ કેટલાક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જાવેદ તેમના પિતાને મળવા આવતા હતા. તે સમયે તેઓ સલીમ-જાવેદની જોડીને ઘમંડી ગણતી હતી. પાછળથી ખબર પડી કે જાવેદ બિલકુલ તેમના પિતા જેવા હતા. આ પછી તેમની મિત્રતા વધી. લગ્નનો નિર્ણય પણ સરળ નહોતો. જાવેદ બે બાળકોનો પિતા હતા. ૨-૩ વાર બ્રેકઅપ થયું પણ પછી લગ્ન થઈ ગયા.

ગુજરાત સાયન્સ સિટી, શ્રી મહાલક્ષ્મી ગ્રામીણ શિક્ષણ અને તાલીમ ભવન અને તાલીમ ભવન અને તકશિલા શાળા વિકાસ સંઘના સહયોગથી ઘાટલોડિયાની શાળામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું

અમદાવાદ, તા.૨૪ | ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યા વિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટી, જિલ્લા શિક્ષણ કચેરી ગ્રામ્ય, શ્રી મહાલક્ષ્મી ગ્રામીણ શિક્ષણ અને તાલીમ ભવન તથા તકશિલા શાળા વિકાસ સંઘના સહયોગથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ અને અતિથિ વિશેષ તરીકે ડો. જે.વી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. વ્રજેશ પરીખે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ નિહાળીને પુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે બાળ-કિશોર વૈજ્ઞાનિકોને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે તથા ભવિષ્યમાં પૃથ્વી પર આવનારા પડકારો વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન અને



પર્યાવરણના વિષયમાં રસ-રૂચિ કેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો નિહાળવા તેમજ સાયન્સ સિટીમાં યોજાતા કાર્યક્રમોમાં સહભાગી થવા માટે ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું.

ઝાલોદ તાલુકાના લીમડી મથકમાં પોલિસ ડારા દિવાળી પૂર્વે ૪,૪૮,૮૪૦ રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી

(પ્રતિનિધી) ઝાલોદ, તા.૨૪ | ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ દિવાળી પૂર્વે અનિચ્છનીય બનાવ ન બને અને ગેરકાયદેસર કામગીરી કરતા ઈસમો પર સતત વોચ રાખી પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રહેલ છે. તારીખ ૨૩-૧૦-૨૦૨૪ બુધવારના રોજ લીમડી પોલિસ મીરાપેડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટાટા કંપનીની સિલ્વર કલરની સફારી ફોર વ્હીલર ગાડી GJ-20-A-5101 ના વિદેશી દારૂ ભરી એક વ્યક્તિ રૂપાખંડ થઈ કંબોઈ ગામ તરફ આવી રહેલ છે ત્યારે પોલિસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી બાતમી

વાળી ગાડીની વોચ કરી રહેલ હતા ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા તે ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. પોલિસ દ્વારા વધુ તપાસ કરી ડ્રાઈવર વનરાજ રમેશ નિનામા, નાની હાંડી, ઝાલોદ ની અટકાયત કરી હતી. લીમડી પોલિસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડી માંથી બિયરની ૨૨ પેટી જેમાં ૬૪૮ નંગ વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કિંમત ૯૩૮૮૦ અને ફોર વ્હીલર ગાડીની અંદાજિત કિંમત ૩૫૦૦૦૦ તેમજ ૫૦૦૦ નો એક મોબાઈલ થઈ કુલ ૪,૪૮,૮૪૦ ના મુદ્દામાલની ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ઘાટે દિપ પ્રાગટ્ય કરી મહા આરતીમાં સહભાગી

થરો : ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભરે ભાગ લેશે | (માહિતી) અમદાવાદ, તા.૨૪ | આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લાના એકતાનગર- કેવડિયા ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદી ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરંડ કાર્યક્રમ યોજાશે. શુભપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા નર્મદા ઘાટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ દિપોત્સવી પ્રાગટ્ય પર્વ-૨૦૨૪ કાર્યક્રમ ૩૦મી ઓક્ટોબરે નર્મદા ઘાટ ઉપર સાંધા આરતી-આતશબાજી-દિપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રીશ્રી સાંધ્ય નર્મદા મહા આરતીમાં દિપ પ્રાગટ્ય કરીને આરતીનો પ્રારંભ કરાવશે. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજ્યના સરિષ્ટ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આરતીમાં ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા આસ્થા સાથે આ આરતીમાં

સામેલ બનશે. અને ૧.૫૦ લાખથી વધુ દિવાડાઓ પ્રગટાવી માં રેવાનો આ પવિત્ર ઘાટ રોશનીથી જળહળી ઉઠશે. અને નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે. તા.૨૩મી ઓક્ટોબરે સાંજે કલેક્ટર કચેરી ખાતેના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટરશ્રી નારાયણ માધુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંપાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ કલેક્ટરશ્રી દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી સહિત ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને સુચારૂ આયોજન અમલવારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

સાણંદ તાલુકામાં સગર્ભા માતાઓ માટે ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન

(માહિતી) અમદાવાદ, તા.૨૪ | અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઘટક ૧ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતના આઈસીટીએસ વિભાગ અને માનવસેવા ટ્રસ્ટના સહયોગથી સગર્ભા માતાઓની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓનું ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેમને પોષ્ટિક સુખપીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, માનવ સેવા સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

સામેલ બનશે. અને ૧.૫૦ લાખથી વધુ દિવાડાઓ પ્રગટાવી માં રેવાનો આ પવિત્ર ઘાટ રોશનીથી જળહળી ઉઠશે. અને નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે. તા.૨૩મી ઓક્ટોબરે સાંજે કલેક્ટર કચેરી ખાતેના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટરશ્રી નારાયણ માધુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંપાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ કલેક્ટરશ્રી દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી સહિત ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને સુચારૂ આયોજન અમલવારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.



થરા કરિયાણા બજારમાં મળતી ભેળસેળયુક્ત તેલ ઘી જેવી ખાદ્યચીજ વસ્તુઓ..તંત્ર ચૂપ

દિવાળી ઉઠવાના કરી રહ્યાં છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ | (પ્રતિનિધી) થરા, તા.૨૪ | કાળજીળ મોઢવારીએ આમઆદમીની જિંદગી કફોડી બનાવી દીધી છે.ત્યારે બીજી તરફ ભેળસેળિયા નકલખોર તત્વો બેકામ બન્યા છે દિવાળીના તહેવારો આડે બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરમાં કરિયાણા ફરસાણ મીઠાઈઓની દુકાનોમાં ભેળસેળયુક્ત તેલ ઘી માવા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ કોઈપણ જાતના ભય વગર ખુલ્લેઆમ મળી રહી છે ત્યારે કેટલાક નકકી કરેલી મોટી દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કે કર્મચારી આવા વેપારીઓ પાસેથી કરેલ ઉધરાણાંની રકમ લઈને સખ સલામત હોવાનો ઓડકાર ખાઈ રાજી થતા થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કે કર્મચારી રવાના થઈ જાય છે. થરા નગરમાં દરેક કરિયાણા મીઠાઈની દુકાને જાહેરમાં ભેળસેળયુક્ત તેલ ઘી માવા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ વેચી રહી છે. જાણીતી કંપનીઓના નામના ડબ્બાઓમાં ભેળસેળવાળું તેલ,

શુદ્ધ ગાયનું ઘી કરિયાણાની દુકાને જાહેરમાં મળી રહ્યું છે તો ભેળસેળયુક્ત માવામાંથી બનાવેલ પેંડા બરકી કાજુ કતરી રોલ જેવી ખાદ્ય ચીજવસ્તુઓથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે પણ ભ્રષ્ટ્ર અધિકારીઓ હમો લઈ પુશ જોવા મળી રહ્યા છે આ ખાધ તેલ ઘી માવાથી તેમના પરિવારજનોને નુકસાન થાય તો ખબર પડે. લોકોએ ચૂંટીને મોકલેલા કહેવાતા લોકસેવકો તો ચૂંટાયા પછી સાહેબ બની લોકોના કથા રહે છે એમના ઘરે પેકેટ પહોંચી જાય એટલે એ પણ પુશ..પ્રજા ફરિયાદ કરે ક્યાં?? આ ક્યાં લોકશાહી છે??કાંકરેજ મામલતદાર પાલીકા તંત્ર મોન બની ગયું છે..જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી આ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓને સાથે રાખી થરા નગરમાં એક રાઉન્ડ મારે તો ખબર પડે કે જિલ્લામાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલ ઘી માવા મીઠાઈ ખુલ્લે આમ ધૂમ મચાવે છે. પોલીસ ઈન્સ્પેક્ટર સખ ઈન્સ્પેક્ટર તો બિચારા ચૂપ જ છે. થરા નગરમાં ભેળસેળિયા તત્વો બેકામ બન્યા છે.

ઝાલોદ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય અન્ન-ફૂટોત્સવ તથા દિવ્ય આશીર્વાદ સભા યોજાઈ

(પ્રતિનિધી) ઝાલોદ, તા.૨૪ | તારીખ ૨૩-૧૦-૨૦૨૪ બુધવારના રોજ સાંજે ૬ થી ૯ સુધી સ્વામિનારાયણ મંદિરે ઝાલોદ ખાતે અન્નફૂટોત્સવ તથા દિવ્ય આશીર્વાદ સભા યોજાઈ હતી. આજની આ સભામાં ૧૫૦૦ થી વધુ હરિભક્તોએ અન્નફૂટ દર્શન અને આશીર્વાદ સભાનો લાભ લીધો હતો.

રહેતી આત્માને શુદ્ધ કરવું જોઈએ, સારા આચાર વિચારો ગ્રહણ કરવા જોઈએ, કોઈને પોતાની વાણી થી કડવા વચન ન કહેવા જોઈએ, પરિવારમાં રહેતો વાદ વિવાદ દૂર કરી પ્રેમપૂર્ણ વાતાવરણ બનાવવું જોઈએ હમેશા સાચા માર્ગે જઈ કોઈનું અહિત ન થાય તેવા કાર્યો કરવા જોઈએ. આવા વિચારો જો દરેક વ્યક્તિ પોતાના વિચારમાં લાવી તેનું અનુકરણ કરે તો તેને સાચા અર્થમાં દિવાળી કહેવાય. છેલ્લે પધારેલ આંતો દ્વારા સહુનુ કલ્યાણ થાઓ, મંગલ થાઓ તેવા આશીર્વાદ આપી સહુનુ દિવાળી પર્વ તેમજ આવનાર નૂતન વર્ષ સુખમય અને મંગલમય રહે તેવા સુભાશીષ આપ્યા હતા. આવનાર દરેક ભક્તોએ મંદીરમા દિવ્ય દર્શનનો લ્હાવો અને સત્સંગનો લ્હાવો લઈ મહાપ્રસાદનો લાભ લીધો હતો.



આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ,લ,ઇ) : આજના દિવસે તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જોકે તમે તમારા શાંત સ્વભાવ થી બંધુ ઠીક કરી દેશો દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે.

વૃષભ (બ,વ,ઇ) : આજના દિવસે મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાકવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાકવો. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે. તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાવ.

મિથુન (ક,ઇ,ઘ) : આજના દિવસે તમારું શારીરિક સાર્મય જાકવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. સહકારી પ્રવૃત્તિઓ નફો લાવશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ.

કર્ક (ડ,ઘ) : આજના દિવસે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બંધેની લાવી શકે છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થતાં. નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ.



યુપીમાં મહિલાની સારવાર માટેનો ઓકિસજન સિલેન્ડર ફાટતાં છના મોત

આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકો સુરક્ષિત છે

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદ વિસ્તારમાં એક બીમાર મહિલાની સારવાર માટે રાખવામાં આવેલો ઓકિસજનનો સિલેન્ડર ફાટવાની ઘટનામાં એક જ પરિવારના છ લોકોના કડાણ મોત થયા છે. તાજેતરમાં હોસ્પિટલમાંથી ૪૫ વર્ષીય રુખસાનાને રજા મળી હતી. રુખસાના, તેના પતિ રિયાજુદીન, તેના ત્રણ બાળકો અને પૌત્રીનો જીવ લેનારી આ ત્રાસદી સોમવારે રાત્રે બની હતી. તેના બે માળના ઘરમાં પરિવારના ૧૯ સભ્યો રહેતા હતા. વિસ્ફોટના કારણે ઘર આંશિક ધરાશયી થયું છે. મંગળવારે જ્યારે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહોને કફન ઓઢાડીને ઘરે પરત લાવવામાં આવ્યા, તો અસંખ્ય લોકો આશાપુરી કોલોનીમાં પીડિત પરિવારના ઘરની બહાર પોતાની સંવેદના વ્યક્ત કરવા એકત્ર થયા હતા, અને કડાણ આકંઠમાં વાતાવરણ શોકમય બની ગયું હતું. બુલંદશહેરના જિલ્લા કલેક્ટર ચંદ્રપ્રકાશ સિંહે જણાવ્યું કે, સિકંદરાબાદની આશાપુરી કોલોનીમાં રાત્રે ૮-૩૦થી ૯ કલાકની વચ્ચે સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકો સુરક્ષિત છે. આ વિસ્ફોટમાં રિયાજુદીન(૫૦), તેની પત્ની રુખસાના(૪૫), તેનો પુત્ર આસ મોહમ્મદ(૨૬), સલમાન(૧૬), પુત્રી તમન્ના(૨૪) અને તેમની પૌત્રી હિબ્બા(૩)નું મોત નીપજ્યું હતું. તમામની અંતિમ વિધિ મંગળવારે બપોરે કરવામાં આવી હતી. આ પહેલા પોલીસ, ફાયરબ્રિગેડ, વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે દબાયેલા લોકોના સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ માટે રાહત-બચાવની કામગીરી ત્રણ કલાક ચાલી હતી.

ચીન પર વિશ્વાસ કરી શકાય? ભારતના વિદેશ સચિવે દ્વિપક્ષીય વાતચીત બાદ આપ્યો હતો જવાબ

રશિયાના કાઝાન શહેરમાં આયોજિત બ્રિક્સ સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. ૨૦૨૦માં ગલવાન અથડામણ બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં બંને દેશોના નેતાઓએ સરહદ સુરક્ષાથી લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ છે. આ સંબંધો માત્ર બંને દેશો માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. પરસ્પર આદર, વિશ્વાસ અને સંવેદનશીલતા સંબંધોને આગળ વધારવાનો માર્ગ બતાવશે. પરંતુ સવાલ એ છે કે ૧૯૬૨થી લઈને ડોકલામ અને ગલવાન સુધી વારંવાર પોતાનો વિશ્વાસ તોડનાર ચીન પર ભારત કેવી રીતે અને કેટલી હદે ભરોસો કરી શકશે? આ સવાલનો જવાબ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ત્યારે આપ્યો જ્યારે વિદેશ મંત્રાલયે દ્વિપક્ષીય વાટાઘાટોની બ્રિફિંગ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. આ દરમિયાન એક પત્રકારે એક પ્રશ્ન પૂછ્યો કે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ શું એવું કહી શકાય કે ભારત અને ચીનના સંબંધો હવે સામાન્ય થઈ ગયા છે.

૫૦૦ મિલિયન ડોલરનું સોનું અને રોકડ દિવાળીના દિવસે ગુપ્ત ખખનો ઇઝરાયેલ એરફોર્સે ક્યો કબજે



આ હુમલાએ ટેશની સૌથી મોટી રફિક હરિરી યુનિવર્સિટી હોસ્પિટલને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયેલે આ ઉપરાંત લેબનોન સીરિયા બોર્ડર પર પણ હુમલો કર્યો હતો. તેના લીધે લેબનોનથી સીરિયા જતો મોટરમાર્ગો રસ્તો બંધ થઈ ગયો હતો. તે સર્વવિદિત છે. બૈરુતની મધ્યમાં રહેલી ખલ સાલેહ હોસ્પિટલમાં નીચે રહેલાં ખાનગી બંકરમાં નસરૂલ્લાહ ઘુપાયો હતો. અહીંથી જ તે અને તેના સાથીઓ હિજબુલ્લાહ આતંકીઓને પૈસા પહોંચાડતા હતા. આ એટલી મોટી રકમ છે કે તે ખંડેર બની ગયેલાં લેબનોનનાં પાટનગર બૈરુતને ફરી બાંધવા માટે પૂરતી થઈ શકે તેમ છે. ઇઝરાયેલે હિજબુલ્લાહ નાં ૩૦ પાકી માહિતી મળતાં અમે તે હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો. પછી તે બંકરમાં પ્રબળ ટોચો લઈ ઉતરતાં. આ અઢળક ખખનો મળી આવ્યો હતો. આ દરમિયાન ઇઝરાયેલે બૈરુતની સૌથી મોટી હોસ્પિટલ પર કરેલા હુમલામાં ૧૩ના મોત થયા છે અને ૫૭થી વધારે લોકો પામ્યા છે. હિજબુલ્લાહ મંગળવારે સેન્ટ્રલ ઇઝરાયેલ આ પહેલા આ બિલ્ડિંગ ઉડાડવાની ૪૦ મિનિટ પહેલા ચેતવણી આપી હતી અને પછી સ્ટ્રાઈક કરાઈ છે. ઇઝરાયેલના નુકસાન કરી શક્યા ન હતા.

નવેમ્બરમાં મંગળવાર જ કેમ નક્કી કરવામાં આવ્યો? અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર મંગળવારે જ કેમ થાય છે?

અમેરિકામાં છેલ્લા ૧૭૦ વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે જ થાય છે. તેની શરૂઆત ૧૮૪૦ના દાયકામાં થઈ હતી. વર્ષ ૧૮૪૫માં યુએસ કોંગ્રેસે એક કાયદો બનાવ્યો હતો, જેના હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહનો મંગળવાર નક્કી કરવામાં આવ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ૫ નવેમ્બરે યોજાશે. એ દિવસ મંગળવાર છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં છેલ્લા ૧૭૦ વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે જ થાય છે. તેની શરૂઆત ૧૮૪૦ના દાયકામાં થઈ હતી. વર્ષ ૧૮૪૫માં યુએસ કોંગ્રેસે એક કાયદો બનાવ્યો હતો, જેના હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહનો મંગળવાર નક્કી કરવામાં આવ્યો હતો. ૧૮૪૫માં ચૂંટણી માટેનો દિવસ નક્કી કરતા પહેલા અમેરિકાના દરેક રાજ્યને કોઈપણ દિવસે ચૂંટણી યોજવાની મંજૂરી આપવામાં આવી હતી. તેઓ તેમની અનુકૂળતા અને સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર ચૂંટણીની તારીખ નક્કી કરી શકતા હતા. ૧૮૪૦ પહેલા ટેશની સીટો પર અલગ-અલગ દિવસે મતદાન થતું હતું. એ જમાનામાં કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનની બહુ સગવડ નહોતી. આવી સ્થિતિમાં એક સીટના મતદાનને કારણે બીજી સીટના વોટિંગ પર અસર પડે કે મતદારોને પ્રભાવિત કરી શકાય તેવો ભય ન હતો. જોકે, ૧૮૪૦ પછી રેલ, રોડ, ટેલિગ્રાફ વગેરે શરૂ થતાં અલગ-અલગ દિવસે મતદાનથી મતદારોને પ્રભાવિત કરી શકાય છે તેવી ભીતિ વધી હતી. આને રોકવા માટે સમાન ચૂંટણીની તારીખની જોગવાઈ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો અને દિવસ નક્કી કરતી વખતે ઘણા પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો. અને પછી નિર્ણય લેવામાં આવ્યો કે નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે અમેરિકામાં લગભગ તમામ પાક નવેમ્બર પહેલા લેવામાં આવે છે. એક રીતે ખેડૂતો તેમના કામમાંથી મુક્ત થઈને મતદાન કરવા જઈ શકે છે. ત્યાં સુધી વધારે ઠંડી પણ નથી પડતી. તેથી નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવતો હતો. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો નક્કી કર્યા પછી દિવસ પસંદ કરવાનો વારો આવ્યો, ત્યારે વીક એન્ડ પર ચૂંટણી યોજવાની ચર્ચા થઈ, પરંતુ ઘણા અમેરિકનોને શનિવાર-રવિવારે પ્રવાસ કરવાનું પસંદ નથી.

૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, UBT અને NCP વચ્ચે ૮૫-૮૫ બેઠકો પર લડવા સહમતિ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડી (એમવીએ)ના ત્રણેય સહયોગીઓ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી(શરદચંદ્ર) વચ્ચે સીટ વહેંચણીને લઈને ખેંચાટાણા ચાલી રહી હતી. જોકે, ત્રણેય સહયોગી પક્ષોએ સાથે મળીને ૮૫-૮૫ સીટ પર ચૂંટણી લડવા સહમતી વ્યક્ત કરી છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ૨૦મી નવેમ્બરે યોજનાર ચૂંટણી માટે ૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી થઈ ગઈ છે. અમે સમાજવાદી પાર્ટી, પીડબ્લ્યુપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ અને આમ આદમી પાર્ટીને સામેલ કરીશું. બાકી રહેલી સીટો માટે હજુ ચર્ચા ચાલી રહી છે. અમે મૈત્રીપૂર્ણ રીતે ૨૭૦ સીટો પર સહમતી પર પહોંચી ગયા છે. મહાયુતિ(ભાજપ, શિવસેના-શિંદ અને એનસીપી-અજીત)ને હરાવવા માટે એકસંપ છીએ. આ સાથે પ્રદેશ પર ચૂંટણી લડવા સહમતી વ્યક્ત કરી છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ૨૦મી નવેમ્બરે યોજનાર ચૂંટણી માટે ૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી થઈ ગઈ છે. અમે સમાજવાદી પાર્ટી, પીડબ્લ્યુપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ અને આમ આદમી પાર્ટીને સામેલ કરીશું. બાકી રહેલી સીટો માટે હજુ ચર્ચા ચાલી રહી છે. અમે મૈત્રીપૂર્ણ રીતે ૨૭૦ સીટો પર સહમતી પર પહોંચી ગયા છે. મહાયુતિ(ભાજપ, શિવસેના-શિંદ અને એનસીપી-અજીત)ને હરાવવા માટે એકસંપ છીએ. આ સાથે પ્રદેશ પર ચૂંટણી લડવા સહમતી વ્યક્ત કરી છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ૨૦મી નવેમ્બરે યોજનાર ચૂંટણી માટે ૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી થઈ ગઈ છે. અમે સમાજવાદી

હાઈવે પર ટાયર બદલતાં લોકોને ટ્રુકે મારી ટક્કર

ઉત્તરપ્રદેશથી વધુ એક ગમખવાર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં બુલંદશહેરના કાસગંજથી ત્રણ મેક્સ ગાડીઓમાં અનાજ ભરીને જહાંગીરાબાદ મંડી વેચવા જતાં ત્રણ લોકો ટ્રુકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી ગયા. જોકે એક અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. અલીગઢ તરફથી આવતા એક ટ્રુકે આ લોકોને ટક્કર મારી હતી. ત્રણેય લોકો હાઈવે પર તેમની ગાડી પંચર થઈ જતાં ટાયર બદલી રહ્યા હતા અને તે સમયે જ ટ્રુકે તેમને ફંગોળી નાખ્યા હતા. આ ઘટના દાનપુર ગામ નજીક બની હતી. ઘટના બાદ અકસ્માત સર્જનારો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતકોની ઓળખ સતીશ ચંદ્ર, રામસિંહ, અને સંજુ તરીકે થઈ હતી. આ ત્રણેય લોકો કાસગંજના વતની હતા. દુર્ઘટનામાં વિજય નામના યુવકને ઈજાઓ પહોંચી હતી.

૩૧ ઓક્ટોબર કે ૧ નવેમ્બર દિવાળી ક્યા દિવસે ઉજવાશે?

૧ નવેમ્બરના જ દિવાળીની ઉજવણી કરે. અનેક લોકો અલગ-અલગ વિધિ લખી નાખે છે. અમારી ગણતરી પ્રમાણે ૧ નવેમ્બરે જ દિવાળી મનાવાશે. બીજી તરફ ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોને મતે આ વર્ષે ૩૧ ઓક્ટોબરે જ દિવાળી મનાવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો જરૂરી હોય છે. ૩૧ ઓક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે અને એટલે આ દિવસે જ દિવાળી મનાવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિદ્યા વિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે ૧ નવેમ્બરે દિવાળી છે જ નહીં અને અમારી ગણતરી પ્રમાણે ૩૧ ઓક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ. આ અંગે જ્યોતિષી અગ્નિદત્ત પદ્માભ અગ્નિદત્તીએ જણાવ્યું કે, '૩૧ ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યાથી અમાસ છે. દિવાળીએ રાતનો તહેવાર છે અને જેના કારણે ૩૧મીએ જ દિવાળીની ઉજવણી કરવી જોઈએ.'

આદિજાતિ વિકાસ વિભાગે એવું કાર્ય કરવાનું છે કે અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લઈને પોતાના રાજ્યમાં કામ કરે : મંત્રી કુંવરજીભાઈ હળપતિ

આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આત્મનિર્ભર બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુંબેરભાઈ ડીંડોર

વિકસિત ભારત @2047ના ભાગરૂપે ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુંબેરભાઈ ડીંડોર અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. ચિંતન શિબિરનો શુભારંભ કરાવતા કેબીનેટ મંત્રી ડો. કુંબેરભાઈ ડીંડોરે આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આત્મનિર્ભર બનાવવા માટે સૌને સંકલ્પબદ્ધ બનાવવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં નવા વિચાર, નવા સંકલ્પ, અને નવી ઊર્જા સાથે આપણે સૌ આદિજાતિ વિકાસના ઉત્થાન માટે કાર્ય કરવાનું છે. આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લઈ રહેલા અધિકારીઓએ કઈ રીતે આદિવાસી નાગરિકો આર્થિક રીતે



વધુને વધુ સફળ થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સૌ એ આત્મમંથન કરીને તે દિશામાં કામ કરી આયોજન કરવાનું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ-૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી તેની સફળતાને પરિણામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હાલ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના-૨ કાર્યરત છે, આ વર્ષે બજેટમાં આદિવાસીઓના ઉત્થાન માટે રૂ.૩૪૭ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગલ્ડેન્સ સિટરસી સ્કૂલ્સ વગેરે યોજનાઓના માધ્યમ થકી રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષિત બનાવી મુખ્ય હરોળમાં લાવવાનો પ્રયાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિકસિત ભારતજરૂર ૨૦૪૭ નિર્માણ માટે વડાપ્રધાન શ્રી

વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર મારફતે સૌ અધિકારીઓએ આદિજાતિના વિકાસ માટે વિચાર કરી તેમના જીવનને આગળ લાવવાની દિશામાં કાર્ય કરવાનું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે છેવાડાના માનવીનો સર્વોર્ગી વિકાસ થશે. આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ આદિવાસી સમાજને આગળ લાવવા એવું કાર્ય કરવાનું છે, અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લઈને પોતાના રાજ્યમાં તે દિશામાં કાર્ય કરે તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુમા, આદિજાતિ વિકાસના કમિશનર શ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તેમજ ચિંતન શિબિરમાં અધિકારીઓ મારફતે આવનારા સમયમાં આદિવાસીઓને મળે તેવી આશા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. આદિજાતિ

